

# ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪, શનિવાર  
વિક્રમ સંવત ૨૦૮૦, મહા સુદ આઠમ

વર્ષ : ૧૫  
અંક : ૧૯૭

તંત્રી : પટેલ સુરેશ રમણલાલ  
અમદાવાદ

કિંમત : રૂ. ૨.૦૦  
પાના : ૮

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

## ન્યૂઝ ડ્રિફ્ટ

### રાહુલની ભારત જોડો ન્યાય યાત્રામાં તેજસ્વી યાદવ જોડાયા



। (એજન્સી) પટના, તા.૧૬ । ભારત જોડો ન્યાય યાત્રામાં બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જોડાયા હતા. તેમણે શુક્રવારે સાસારામમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને જોઈને ક્યાં હતા. આ દરમિયાન બંને વચ્ચેની મિત્રતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સૌથી રસપ્રદ નજારો એ હતો કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એક જ ગાડીમાં બેઠા હતા. જેમાં તેજસ્વી યાદવ ડ્રાઈવ કરી રહ્યા હતા અને રાહુલ ગાંધી બાજુની સીટ પર બેઠા હતા.

### અયોધ્યા રામમંદિરને બોમ્બથી ઊડાડી દેવાની ધમકીથી એલર્ટ



। (એજન્સી) અયોધ્યા, તા.૧૬ । ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ બાદ મંદિરને સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં લાખો શ્રદાળુઓએ પ્રભુ રામના દર્શન કર્યા છે. દેશભરમાંથી દરરોજ લાખો રામભક્તો રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા આવે છે ત્યારે હવે રામ મંદિરને બોમ્બથી ઊડાડી દેવાની ધમકી મળી છે તેની સાથે લખનઉના બક્ષીના તળાવ (બીકેટી)ને પણ બોમ્બથી ઊડાડી દેવાની ધમકી આપવામાં આવી છે.

### બેકાબૂ ભીડે જિલ્લા પોલીસ વડાની ઓફિસની બહાર વાહનો ફૂંકી માર્યા

। (એજન્સી) ઈન્ડોર, તા.૧૬ । મહિપુરથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવ્યા છે. મહિપુરના ચુરાસંદપુરમાં ભીડ અને પોલીસ વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ૨૫ લોકો ઘાયલ થયા હતા. એક વીડિયોમાં ક્રિષિત રીતે હથિયારધારી માણસો સાથે જોવા મળ્યા બાદ જિલ્લા પોલીસના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સામે ભીડ વિરોધ કરી રહી છે. પોલીસે કહ્યું કે, જિલ્લામાં તણાવ છે.

# ૨૨ કાર અને ૫ દુકાનો પણ આગની લપેટમાં આવતા બળીને ભડથું દિલ્હીના અલીપુર વિસ્તારમાં પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ : ૧૧ના મોત



। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । દિલ્હીના અલીપુર વિસ્તારમાં ગુરુવારે સાંજે એક પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં ૧૧ લોકોનો દાગી જવાથી મોત થયા છે. આગ એટલી ભીષણ હતી કે ૨૨ કાર અને ૫ દુકાનો પણ આગની લપેટમાં આવતા બળીને ભડથું થઈ ગઈ હતી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડની ટીમે ૨૨ ફાયર ટેકરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. ગુરુવારે સાંજે ૫ કલાકની આસપાસ દિલ્હીના અલીપુર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં ૧૧ લોકોના દાગી જવાથી મોત થયા હતા. શરૂઆતમાં ફાયર બ્રિગેડની ટીમે ફેક્ટરીમાંથી ૩ મુતદેહને બહાર કાઢ્યા હતા. બાદમાં આગ બુગાવ્યા બાદ જ્યારે ફેક્ટરીની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, ત્યારે વધુ બળી ગયેલા મુતદેહો મળી આવ્યા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આ પેઇન્ટ ફેક્ટરી ગાઢ વિસ્તારમાં હોવાથી ૨૨ કાર અને ૫ દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી.

## ફાયર બ્રિગેડની ૨૨ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી



પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલ આગ લાગવાનું કારણ શું હોઈ શકે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ૨૨ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. હવે ફેક્ટરીમાં મળેલા મુતદેહોની ઝાળખ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ હાઈલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ગુરુવારે સાંજે અલીપુર વિસ્તારમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડને આ માહિતી આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ડુગાવવાનું શરૂ કર્યું હતું. આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે અંદર જઈને તપાસ કરી તો ત્રણ લોકો દાગી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે આગના સમાચાર મળ્યા હતા. દયાલપુર અલીપુરના એચ ઓકમાં આવેલી પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જે પછી શરૂઆતમાં ૮ ફાયર ટેન્કર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આગ વધુ ફેલાઈ ત્યારે ૨૨ ફાયર ટેન્કર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.



હરિયાણામાં રેવાડી ખાતે બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદઘાટન અને શિલાન્યાસ દરમિયાન એક પ્રદર્શનની મુલાકાત લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

# ખેડૂતો સાથે ત્રીજા રાઉન્ડમાં ૫ ક્લાક સુધી ચાલી મંત્રણા

## અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાયે ચંડીગઢમાં વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે વાત કરી

। (એજન્સી) ચંડીગઢ, તા.૧૬ । ચંડીગઢમાં લગભગ ૫ કલાકની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચેની મંત્રણા સમાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે વાટાઘાટો થઈ હતી પરંતુ કોઈ બાબત પર સહમતિ સધાઈ નથી. જો કે, ઘણા મુદ્દાઓ પર મંત્રણા આગળ ધપાવવાના અને મંત્રણા સકારાત્મક રહેવાના સંકેતો મળ્યા છે. આ અંગે રવિવારે બીજી બેઠક મળશે. રવિવારની બેઠક સુધી ખેડૂતો શંભુ બોર્ડર પર આગળ નહીં વધે. સાથે જ હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ પણ યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે. ખેડૂતો સાથેની બેઠક અંગે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, “ખૂબ જ સારા વાતાવરણમાં સકારાત્મક ચર્ચા થઈ અને ખેડૂત સંગઠનોએ જે મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે તેને ધ્યાનમાં લઈને આગામી તારીખે વિગતવાર ચર્ચા કરવામાં આવશે, એટલે કે રવિવારે સાંજે.” અમે ફરીથી ૬ વાગ્યે ચર્ચા ચાલુ રાખીશું.” તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય હાજર હતા. આ સિવાય પંજાબની સીએમ ભગવંત માન પણ બેઠકમાં સામેલ થયા હતા. પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પંજાબના ખેડૂતો આ મામલે ખૂબ જ પ્રભાવિત છે. તેથી, રાજ્યના વડા હોવાના કારણે, આ બેઠકમાં

તેમનો પણ રજૂ કરવાની મારી ફરજ છે. બેઠકમાં તમામ મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચાઓ થઈ હતી. અમે બેઠકમાં પંજાબ સરકાર સાથે સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવ્યા, ખાસ કરીને કેન્દ્ર સરકાર કે જેણે અમારા ત્રણ જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. વિદ્યાર્થીઓની પરીક્ષાઓ છે, આવી સ્થિતિમાં તેમને ઓનલાઈન અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે બેઠકમાં પૂછ્યું કે ખેડૂતો સરહદ પર બેઠા છે તો અમારા વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરવાની શું જરૂર હતી? સીએમએ કહ્યું કે, અમે પંજાબ બોર્ડર પર અમારા ખેડૂતો પર ડ્રોનથી ટીયર ગેસના શેલ છોડવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે.

# કોંગ્રેસ-યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા આઈટી ટ્રીબ્યુનલે કોઈ જ રાહત આપ્યાનો કોંગ્રેસનો ઈનકાર

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ સીઝ થવાના અહેવાલ જ્યારથી આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાઈ ગયું છે. સૌથી પહેલા એવા અહેવાલ આવ્યા કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે ૨૧૦ કરોડ રૂપિયાની રિકવરીની માગ કરી હતી. ત્યારબાદ આ મામલો આવકવેરા વિભાગ અને આવકવેરા વિભાગના અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પહોંચ્યો હતો જ્યાંથી બુધવાર સુધી કોંગ્રેસને રાહત મળવાના અહેવાલ મળ્યાં હતાં.

પરંતુ શું ખરેખર રાહત મળી? આ અહેવાલ બાદ એવી ચર્ચા થઈ કે આ મામલે કોંગ્રેસને રાહત મળી ગઈ છે અને તેના એકાઉન્ટ અનલોક થઈ ગયા છે. જોકે અજય માકનના જણાવ્યાનુસાર એવું થયું જ નથી. કોંગ્રેસને આવકવેરા વિભાગના ટ્રિબ્યુનલ તરફથી કોઈ રાહત અપાઈ જ નથી. તેમણે કહ્યું કે આઈટી ટ્રિબ્યુનલ દ્વારા કોંગ્રેસ સામે તેના એકાઉન્ટમાં ૧૧૫ કરોડ રૂપિયા રાખવાની શરત મૂકી દેવામાં આવી છે. આ સાથે કહેવાયું છે કે આ રકમ પર લિન માર્ક લગાવી દેવાયું છે. જેનો અર્થ એ છે કે અમે તેનાથી ઉપરની જ રકમને વાપરી શકીશું.

# દરિયાઈ સુરક્ષા વધારવા સંરક્ષણ મંત્રાલયનો નિર્ણય ૨૯,૦૦૦ કરોડની કિંમતના સર્વેલન્સ એરક્રાફ્ટ ખરીદવા કેન્દ્રની મંજૂરી

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । દેશની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવા સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો મુજબ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે ૮ મેરીટાઈમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે ૬ મેરીટાઈમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ બનાવાશે. આ કરારની કુલ કિંમત ૨૯,૦૦૦ કરોડ રૂપિયા છે. બુધવારે સંરક્ષણ મંત્રાલયે કાનપુર સ્થિત એક કંપની સાથે ૧૭૫૨.૧૩ કરોડ રૂપિયાની ડીલના કરાર કર્યાં છે. કરાર મુજબ ૪૬૩, ૧૨.૭ એએમની રિમોટ કંટ્રોલ બંદૂકનું પણ નિર્માણ કરાશે.

સમાચાર પત્ર છે લોકતંત્રનો ચૌથો સ્તંભ અને પ્રાણ, જે કરે છે એક લોકતંત્રનો નિર્માણ !

**CHANNEL NINE NETWORK GUJARAT**  
◆ ન્યૂઝ પેપર, ◆ ન્યૂઝ ચેનલ, ◆ ન્યૂઝ વેબસાઈટ

આજે જ **cnngujarat.com** વેબસાઈટ ઉપર વિગ્રીટ કરો અને જોડાઈ જાઓ સમાચારની દુનિયા સાથે...



ન્યૂઝ ફિક્સ

નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે કેજરીવાલ-સંજયસિંહની અપીલ હાઈકોર્ટે ફગાવી

1 (એજન્સી) અમદાવાદ, તા.૧૬ | ગુજરાત યુનિવર્સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીનો કોસ દાખલ કર્યો હતો, જેમાં સેશન્સ કોર્ટે બંનેની અરજીને નકારતા હાઈકોર્ટમાં સમન્સ રદ કરવા અને સ્ટે આપવા અરજી દાખલ કરી હતી, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે બંનેની અરજીને ફગાવી દીધી છે. હવે કેસ મેટ્રો કોર્ટમાં જ ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઈ ગુજરાત યુનિવર્સિટી વિશે બેફામ, વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરાડાય તે પ્રકારના બદનક્ષીભર્યાં નિવેદનો કરવાના પ્રકરણમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ થયો હતો.

ઉધના પોલીસે સ્નેચિંગ કરનાર બાઇકર્સ ગંગને પકડી પાડી

1 (એજન્સી) સુરત, તા.૧૬ | ઉધના પોલીસે સ્નેચિંગ કરનાર બાઈકર્સ ગંગને પકડી પાડી છે. તોફાં ઉઠે કુટેલી ઈબ્રાહીમ, અશફાક ઉઠે માયા કાલિયા શેખ, મોહિત ઉઠે બોબડા ઉઠે પેરા સરવર ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ ગત ૭ ફેબ્રુઆરીએ એક મહિલા પાસેથી ૧ લાખથી વધુની લૂંટ કરી હતી. આ ઘટનાનો ૧૨ ફેબ્રુઆરીએ ગુનો દાખલ થતા પોલીસ સક્રિય થઈ હતી.

કૃષ્ણનગર ડેપોમાંથી ચોરાયેલી એસટી દહેગામથી મળી આવી

1 (એજન્સી) અમદાવાદ, તા.૧૬ | અમદાવાદ વાહનચોરી એક અજબ ઘટના ઘટી છે, જેમાં આપી એસટી બસ ચોરાઈ ગઈ છે. શહેરના કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસ ચોરાઈ ગઈ હતી. બસની ચોરી થતા એસટી વિભાગ સાથે પોલીસ તંત્ર પણ તપાસમાં લાગ્યું હતું. પ્રામ માહિતી અનુસાર, બે કલાક સુધી ભારે શોધખોળ બાદ આ બસ દહેગામથી મળી આવી હતી. પોલીસ તપાસ જણાવ્યાં મળ્યું કે, બસ લઈને ભાગેલો યુવક માનસિક અસ્થિર છે. પોલીસ આ યુવકની પૂછપરછ કરી આગળની તપાસ કરી રહી છે. જો કે, આ ઘટનાએ એસટી તંત્રની સુરક્ષાની પોલ ખોલી નાખી છે. બસ જેવું આટલું મોટું વાહન ચોરાઈ જાય એનાથી મોટી શરમજનક વાત બીજી કંઈ હોઈ શકે.

પોલીસ દ્વારા બેની અટકાયત કરવામાં આવી સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકના મોત

1 (એજન્સી) સુરેન્દ્રનગર, તા.૧૬ | સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણ વધુ એકવાર મોતની ખાણ સાબિત થઈ હતી. સુરેન્દ્રનગરના મૂળીના દેવપરામાં જીલેટીન બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા. ત્રણ શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. થોડા દિવસ પહેલા પ્રશાસને ગેસકાયદે ખાડાનું પુરાણ કર્યું ત્યાં જ અમુક શખ્સો શ્રમિકો પાસે ખોદકામ કરાવતા હતા. શ્રમિકોના મોતને લઈ ખાડાઓ પર ગેસકાયદે કબજો જમાવનાર બે શખ્સની મૂળી પોલીસે અટકાયત કરી હતી.

દેવપરા ગામમાં કોલસાની ખાણમાં ગેસકાયદે બ્લાસ્ટ કરતા સમયે જેરી ગેસ ગળતર થતા ૬ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન છગુભાઈ રાવત, રામદેવસિંહ રાવત અને રાજુભાઈ હરજીભાઈ નામના ત્રણ પરપ્રાંતિય શ્રમિકના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. દુર્ઘટના બાદ મૂળી પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને ગેસકાયદે ખોડેલા ખાડા બંધ કરવાની કામગીરી શરૂ કરી હતી. ખાડા પર ગેસકાયદે કબજો કરનાર બે શખ્સો રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે મૂળીના ખપાળીયા ગઢડા ગામની સીમમાં ૨૪ જાન્યુઆરીએ કૂવો ગળાતી સમયે ભેખડ ધસી પડવાના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.

આમ ૨૧ દિવસમાં જ ખાણ મજૂરોના મોતની બે ગંભીર ઘટનાઓ બનતા પ્રશાસનની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. ખંપાળિયા ગામે કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં ત્રણ કામદારોના મોત કેસમાં કાર્યવાહી શરૂ થઈ હતી. ઘટનાના છ દિવસ બાદ પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. કોલસાની ખાણમાં મોતના કેસમાં પાંચ ભૂમાફિયા સામે ફરિયાદ નોંધાઈ છે. સેફ્ટી વગર કામદારોને ખાણમાં ઉતારતા આ ઘટના બની હતી. જમીન માલિક સહિત પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ હતી. જે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં શામજીભાઈ ધીરુભાઈ ઝેઝરીયા, જનકભાઈ કેશભાઈ પરમાર, કિશોરભાઈ હેમુભાઈ બાવળીયા, દેવશીભાઈ (જમીન માલિક), દિનેશભાઈનો સમાવેશ થાય છે.



લાલ દરવાજા અપના બજાર પાસે સરકારી કર્મચારીઓ દ્વારા તેમની માંગણીઓને લઈને દેખાવો કરવામાં આવ્યા હતા.

હરણી બોટ દુર્ઘટનામાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી

1 (એજન્સી) વડોદરા, તા.૧૬ | હરણી લેકઝોન દુર્ઘટનામાં ૧૨ બાળકો અને ૨ શિક્ષિકોએ જીવ ગુમાવ્યાં હતા. આ ગોઝારી દુર્ઘટનાને પગલે પોલીસે સૌ પ્રથમ ૧૮ ગુનેગારો સામે ફરીયાદ નોંધી છની ધરપકડ કરી હતી. ત્યારબાદ ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ ૧૮ ની પોલીસે ધરપકડ કરી છે. આજરોજ પોલીસે આ ઘટનાના જવાબદાર વધુ ત્રણ ભાગીદારોની ધરપકડ કરી છે. આરોપી પરેશ શાહની પરિવારમાં પુત્ર વત્સલ શાહ, પત્ની નુતન શાહ અને પુત્રી વૈશાખી શાહ છે. વડોદરા શહેર નહીં પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર હરણી બોટ દુર્ઘટનામાં પોલીસે કુલ ૨૧ જવાબદારો સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી ત્યારે પોલીસ દ્વારા ફરાર વત્સલ શાહ, નુતન શાહ, વૈશાખી શાહ ની ધરપકડ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટના કંઈ રીતે ઘટી તે અંગેની તપાસ

અંગે આજ રોજ રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું જેમાં એફએસએલના અધિકારીઓ બોટ મેન્યુફેક્ચર ના પ્રતિનિધિઓ તેમજ ટીમની હાજરીમાં બોટને ફરી હરણી લેક ઝોન તળાવમાં ઉતારી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હરણી તળાવ માં બોટનું બોયાનસી કેપેસિટી ટેસ્ટ કરાયો છે. બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે બોયાનસી ટેસ્ટ કરવામાં આવે છે. હરણી લેક ઝોન ના આરોપી નુતન શાહને હાર્ટ પ્રોબ્લેમ થતા તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા તબીબ પાસે આવતા ધરણા ચોકડી હાઈવે પરથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પુત્ર વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં ૧૦ ટકા નો ભાગીદાર હતો. ત્યારે ૨૦૧૮માં નુતન અને વૈશાખી શાહ ના પ-પ ટકા ભાગીદારી નક્કી કરાઈ હતી જેથી કોરિયા પ્રોજેક્ટના આરોપીઓ ૩૦ ટકા ના ભાગીદાર છે. આરોપીઓ દુર્ઘટના ઘટનાંકરણ થયા હતા. આરોપી પહેલા ભરૂચ બાદ રાજસ્થાન તરફ ફરાર થઈ ગયા હતા. હરણી લેકઝોન નું સંચાલન પરેશ શાહ

અને વત્સલ શાહ કરતા હતા. ઓથોરિટી સિગ્નેચર માં વત્સલ શાહ ની બેફિંગ વ્યવહારો માં ચાલતી હતી. સહિત પોલીસે ૨૦ લોકો સામે સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો જેમાં પોલીસે ૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજુ ૧ આરોપી ધર્મીન ભતાણી પોલીસ પકડ થી દુર છે. મહત્વની વાત છે કે હરણે બોટ કાંડમાં ૧૨ બાળકો અને બે શિક્ષિકાઓની મોત નીપજ્યાં છે. ત્યારે મૃત્યુ પામનાર બાળકોના પરિવાર હજુ પણ ન્યાય માટે તરસી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા નાટકીય મત રીતે એક બાદ એક આરોપીઓને ધરપકડ કરવામાં આવે છે તેવું જણાવવામાં આવે છે. પરંતુ ઘટનાને મહિનો વીતી ગયા હોવા છતાં પણ કડક કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. ઘટના લઈને સ્કૂલ સંચાલકો કે પાલિકા અધિકારીઓ પર કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને ગૃહ વિભાગ તેમજ સરકાર દ્વારા પણ પોલીસ તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ કોઈપણ આરોપીને છોડવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ-હિંમતનગર રેલવે લાઈન થઈ તસ્કરોનો ત્રાસ રેલવે ટ્રેક પર સપ્તાહમાં બીજી વાર કોપર તારની ચોરી થઈ રેલવે ટ્રેક પરથી તસ્કરો નવી ઈલેક્ટ્રીફિકેશન કરાયેલી લાઈનનો કેબલ વીજ પોલ પરથી ઉતારીને તસ્કરો ચોરી કરી ગયા છે

1 (એજન્સી) અમદાવાદ, તા.૧૬ | હિંમતનગરથી અમદાવાદના અસારવાને જોડતી બ્રોડગેજ રેલવે લાઈનનું હાલમાં ઈલેક્ટ્રીફિકેશન થઈ રહ્યું છે. વીજળી થી ચાલતી ટ્રેન દોડવાનું સપનું આ રુટ પરનું પુરુ થવા જઈ રહ્યું છે. આ માટે ઈલેક્ટ્રીફિકેશનનું કાર્ય હવે તેના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન તસ્કરો બેફામ બન્યા છે. રેલવે ટ્રેક પર બીજી વાર નવી વીજ લાઈનનો કોપર તાર ચોરી થયો છે. અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર સુધીની રેલવે લાઈન પર આવનારા દિવસોમાં હવે ડિઝલ એન્જિનની ટ્રેન દોડવાને બદલે વીજળીથી ટ્રેન દોડશે. આ માટે બ્રોડગેજ રેલવે લાઈન પર ઈલેક્ટ્રીફિકેશનનું કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ કાર્યને પૂર્ણ કરવા માટે તસ્કરો પડકાર બન્યા છે. અસારવાથી હિંમતનગર બ્રોડગેજ રેલવે લાઈનના ઈલેક્ટ્રીફિકેશનનું કાર્ય હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્ય હવે તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે તસ્કરોએ કાર્યમાં અવરોધ સર્જી દીધો છે. રેલવે ટ્રેક પર સપ્તાહમાં બીજી વાર કોપર તારની ચોરી થઈ છે. પ્રાંતિજના અમીનપુર રેલવે અન્ડર બ્રિજથી નેશનલ હાઈવે ઈ ટના ઓવરબ્રિજ વચ્ચેના રેલવે ટ્રેક પરથી તસ્કરો નવી ઈલેક્ટ્રીફિકેશન કરાયેલી લાઈનનો કેબલ વીજ પોલ પરથી ઉતારીને તસ્કરો ચોરી કરી ગયા છે. ટ્રેક ઉપરથી બે પ્રકારના લગાવેલા ૧૧૦૭ મીટર કોપર વાયરની ચોરી થઈ છે. જેમાં રૂ ૨.૭૫ લાખનો ૫૪૫ મીટર કોન્ટેક્ટ કોપર વાયરની ચોરી થઈ છે અને રૂ ૪.૪૭ લાખનો ૫૬૨ મીટર કેટેનરી કોપર વાયરને પણ તસ્કરો કાપીને લઈ ગયા છે. આ મામલે પ્રાંતિજ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હવે તસ્કરોને શોધવા માટે પ્રયાસો શરુ કર્યા છે. તસ્કરોના કારણે રેલવે ટ્રેકના ઈલેક્ટ્રીફિકેશન કાર્યને અવરોધ સર્જાઈ રહ્યો છે. કારણ કે સપ્તાહમાં આ બીજીવાર ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છેપાયા દિવસ પહેલા ડભોડા પાસે રેલવે ટ્રેક પર ૮૦૦ મીટર રૂ ૫.૫૦ લાખનો કોપર વાયર ચોરાયો હતો. આમ પાંચ જ દિવસમાં ફરી એકવાર તસ્કરો ત્રાટકવાને લઈ બીજી વાર કોપર વાયરની ટોકી નોંધાઈ છે. ઘટનાને પગલે રેલવે પોલીસ પણ હવે સતર્ક બની છે.

રાજ્યમાં ઠેર ઠેર આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યો આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયને સરકારની સામે બાંધ્યો ચડાવી

1 (એજન્સી) અમદાવાદ, તા.૧૬ | રાજ્યમાં હવે આશા અને હેલ્થ વર્કર યુનિયન તેમજ આંગણવાડી બહેનોએ સરકાર સામે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આંગણવાડી બહેનો ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી એમ બે દિવસ કામથી અળગા રહી હડતાળ પર ઉતરી છે અને ચીમકી ઉચ્ચારી છે કે બે દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આ વિરોધ આગળ પણ શરૂ રહેશે. રાજ્યમાં હવે આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનને સરકાર સામે બાંધ્યો ચડાવી છે અને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજ્યમાં ઠેર ઠેર આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યાં છે. રાજકોટ જિલ્લામાં ૫ હજાર જેટલા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. રાજ્યવ્યાપી હડતાળના પગલે બે દિવસ આંગણવાડી બંધ રહેશે, જેમા આજે પણ આંગણવાડી બહેનોએ કામથી અળગી રહી હતી અને ૧૭ ફેબ્રુઆરીએ પણ તમામ આંગણવાડી બંધ રહેશે. વિરોધ પર ઉતરેલી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે બે દિવસમાં જો સરકાર તેમની માગણીઓ પૂર્ણ નહીં કરે તો આગળ પણ આ વિરોધ શરૂ રહેશે અને તેઓ તમામ કામથી અળગા રહીને વિરોધ નોંધાવશે. હાલ આશા વર્કર, ફેસિલિટર, મધ્યાહન ભોજન વર્કરો કામથી અળગા રહ્યા છે. વિવિધ પડતર માગણીઓને સંતોષવાની આંગણવાડી બહેનોએ હડતાળ પર ઉતરી છે. આ તરફ નવસારીમાં પણ પડતર પ્રશ્નોને લઈને આંગણવાડી બહેનો હડતાળમાં જોડાયા હતા. હડતાળને પગલે જિલ્લાના ચીખલી, ખેરગામ, વાસદા, ગણદેવી, જલાલપોર અને નવસારીની આંગણવાડીઓ બંધ કરવામાં આવી છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ ૨૬ વિભાગના કર્મચારીઓએ આજે કાળો દિવસ મનાવ્યો. જૂની પેન્શન સ્કીમ અને ફિક્સ પેના વિરોધમાં સરકારી કર્મચારી મહામંડળના નેજા હેઠળ જુદા જુદા સંગઠનોએ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો છે.

વિશેષ

૨૩ ગોલ્ડમેડલ અને ૪ સિલ્વરમેડલ મળી કુલ ૨૭ પદકો અને ૭૯૭ પદવી પ્રમાણપત્રો અપાયા

રાજ્યપાલ અને ફુલાધિપતિ આચાર્ય દેવપ્રતજીની અધ્યક્ષતામાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલ અને ફુલાધિપતિ શ્રી આચાર્ય દેવપ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આજે કમ્પ્યુટર પણ સંસ્કૃત ભાષા સૌથી સારી રીતે સમજે છે. રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, સંસ્કૃત એ દરેક પ્રકારની સજ્જ ભાષા છે. એ રીતે તે ખજાનાથી પરિપૂર્ણ ભાષા છે. જે લોકો સંસ્કૃત નથી જાણતા તે અભાગી છે. ગાંધીજીની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા હતાં કે, હું સંસ્કૃત નથી જાણતો તેનો રંજ છે. જે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે. રાજ્યપાલશ્રીએ જીવનવિહિતિમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ જ્યાં જળની જરૂર છે, ત્યાં જળસંરક્ષણ, જ્યાં વૃક્ષોની જરૂર છે, ત્યાં વૃક્ષારોપણ, જ્યાં દીન-દુખી લોકો છે, તેવા લોકોની સેવા, જ્યાં જમીન બંજર છે, ત્યાં પ્રાકૃતિક કૃષિ જેવા પ્રયત્નો દ્વારા સમાજસેવાના કાર્યો કરવા હાકલ કરી હતી.



ધરતી પર આવ્યા છીએ તો એક ઈતિહાસ બનાવીએ, પરિશ્રમી અને તપસ્વી બનીએ. તેમજ રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણ ભાવ કેળવીએ તેવી અપેક્ષા રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી “જિંદગી જિંદાદિલી કા નામ હે, મૂર્દા દિલ ક્યા ખાક જ્યા કરતે હે” તેમ કહી મેળવેલા જ્ઞાનને ઉત્સાહ, ઉમંગથી અન્ય લોકો સાથે વહેંચવા અને પોતાના વ્યક્તિત્વમાં રહેલા અનેક પાસાઓને ઉજાગર કરવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આપણા વેદ, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ સહિતના પરંપરાગત શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે. તેના પર તમામને ગર્વ થવો જોઈએ. આ એક ઋષિ-મનીષીઓની ભાષા છે. સંસ્કૃતના જ્ઞાતા તરીકે એ ભાષા આવડવાનો તમને ગર્વ હોવો જોઈએ. આપણી ગુરુકુળ પરંપરામાં પણ આ જ ભાષાનું અધ્યાપન અને અધ્યયન કરાવવામાં આવતું હતું. આજે પદવી મેળવીને જનારા વિદ્યાર્થીઓમાં જે ઉદ્દેશ્ય માટે તેઓ વિદ્યા મેળવવા માટે આવ્યા હતાં, તે મેળવ્યાની

સિક્કો પણ ચાલે છે. પરંતુ જ્યાં સુધી તેની ખબર નથી પડતી ત્યાં સુધી જ. જ્યારે ખબર પડે છે કે, એ નક્કી છે તો તે પડી ભાંગે છે. અંતિમ તો સત્ય જ છે. અસત્યનો પહાડ ગમે એટલો મોટો હોય પરંતુ સત્ય તેને થીમે થીમે કીડતી નાખે છે. સત્યનું આચરણ કરવાથી આ પૃથ્વી પર સુખ, શાંતિ, નીડરતા, સંતોષ અને આનંદનું વાતાવરણ ઉભું થશે તેમ તેમણે જણાવ્યું હતું. આપણા વેદવિજ્ઞાન વિશે તેમણે જણાવ્યું કે, આજની પૃથ્વી બે અબજ વર્ષ જૂની છે. પશ્ચિમના અમુક વિજ્ઞાનીઓ એવું કહેતા હતા કે, પૃથ્વી ચપટી છે, ચોરસ છે. પરંતુ આપણા ઋષિ વિજ્ઞાનોના શાસ્ત્રો દર્શાવે છે કે, સમગ્ર પૃથ્વી ગોળ છે અને આ કારણોસર જ તેના અભ્યાસને પણ ‘ભૂ-ગોળ’ કહીએ છીએ. જેમાં ખુદ ‘ગોળ’ શબ્દ ઈંગ્લીશ છે. આવા અલભ્ય અને ઐતિહાસિક જ્ઞાન વારસાનું આપણને ગૌરવ હોવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને શીખ આપ તાં જણાવ્યું હતું કે, તમે મેળવેલી વિદ્યા જનમાનસ સુધી ન પહોંચી શકે અને તેમના જીવનના અંધકારને ન ઉલેચી શકે તો આ વિદ્યાનો કોઈ અર્થ નથી. વિદ્યા પ્રકાશવાન, ઉજાસ ફેલાવનાર હોવી જોઈએ. આ વિદ્યાના જ્ઞાન સાથે સમાજજીવનમાં જ્યાં અધૂરપ છે, તેને પૂર્ણ કરવાનું કાર્ય કરી સમાજને દિવ્ય, ભવ્ય અને ગુણી બનાવવાનું કર્તવ્ય નિભાવવાનું છે. જે રીતે વાદળો સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવી અને જ્યાં જરૂરિયાત છે ત્યાં વરસાવે છે. તે રીતે જ તમારે તમારા જ્ઞાનને જ્યાં જરૂરી છે. ત્યાં વહેંચીને જ્ઞાનનો પ્રકાશ

વહેતો કરવાનો છે. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતે સમયે સમયે દેશને અનેક મહાનુભાવો આપ્યા છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતની ભવ્ય ખાતે યોજાઈ રહેલા વિરાસતને બચાવવાની સાથે જ ભોતિક રીતે ઉત્તરના સગે અગ્રેસર બનાવી રહ્યાં છે. એક મોટું કાર્ય પૂર્ણ થાય ત્યાં બીજું મોટું કાર્ય ઉપાડે છે. દેશને વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત બનાવવા માટે આપણે સારા નાગરિક તરીકેની ફરજ બજાવી આપણું યોગદાન આપીએ. રાજ્યપાલશ્રીએ આજના એક અખબારમાં આવેલી જાનનગરના એક ખેડૂત યુવાનની વાત કહીને કઈ રીતે આ સામાજિક ખેડૂત પોતાની પત્નીના ખાડામાં પડવાના કારણે થયેલા મૃત્યુને એક કારણ બનાવીને સમાજના હિત ખાતર પોતાના ખિરસાના રૂ.૨૧ લાખ ખર્ચીને પ્રદેશમાં પરેલા ખાડાઓને પૂરવામાં લાગેલો છે. તેની લાગણીસભર વાત કરી આ પ્રકારના જીવંત અને જવાબદાર નાગરિક બનવાની શીખ ઉપસ્થિત વિદ્યાર્થીઓને આપી હતી. આ તે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ શુભેચ્છા સંદેશ પાઠવતાં વચ્ચેથી જણાવ્યું હતું કે, સંસ્કૃતિ જીવંત રાખવાનો ભગીરથ પ્રયાસ એટલે સંસ્કૃત. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યુનિવર્સિટીનો પાયો નાખ્યો, ત્યારે એ દ્રષ્ટિથી પાયો નાખ્યો હતો કે સંસ્કૃતનું જતન આવેલે સંસ્કૃતિનું જતન થાય. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, દુનિયાએ સંસ્કૃત અને ભારતની સંસ્કૃતિ અપનાવવી પડશે.







## તંત્રી લેખ...

ઈટલીની રાજધાની રોમની સડકો  
પર ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખેડૂત આંદોલનો પોતાનો ઈતિહાસ છે. ભારતીય ખેડૂતોનું આંદોલન આ દિવસોમાં સમાચારોમાં છે, પરંતુ યુરોપના ઘણા દેશોમાં પણ ખેડૂતો સરકારની નીતિઓ સામે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. યુરોપના લગભગ ૧૦ દેશોમાં જાન્યુઆરીથી ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે. આ દેશોમાં ફ્રાન્સ, પોલેન્ડ, સ્પેન, જર્મની, ઈટાલી, ગ્રીસ, રોમાનિયા, બેલ્જિયમ, પોર્ટુગલ, લિથુઆનિયાનો સમાવેશ થાય છે. ગુરુવારે, વિરોધ કરી રહેલા ખેડૂતોને ઈટાલીના રોમમાં પ્રાચીન સર્કસ મેક્સિમસ પર ડુમલો ક્યાં. સર્કસ મેક્સિમસની આસપાસ ખેડૂતોને તેમના ટ્રેક્ટર ચલાવવાનું શરૂ કર્યું. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઈ. આ સિવાય ખેડૂતોનું એક જૂથ પણ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની ઓફિસ પાસે એકત્ર થયું હતું. આ ઉપરાંત ખેડૂતો તેમની માંગણીઓ સાથે યુરોપિયન યુનિયનની ઓફિસે પણ પહોંચ્યા હતા જ્યાં તેઓએ અધિકારીઓને તેમની ફરિયાદ પત્ર સોંપ્યું હતું. ઈટાલીની રાજધાનીનું આ દ્રશ્ય ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ટેલિવીઝનની સડકો પર જોવા મળ્યું હતું તેવું હતું. આંદોલનકારી ખેડૂતોને મારફતે ટ્રેક્ટરમાં દિલ્હીમાં પ્રવેશવા હતા. ખેડૂતો અહીં ટ્રેક્ટર ચલાવતા હતા. ત્યારબાદ ખેડૂતો લાલ કિલ્લા તરફ આગળ વધ્યા. ખેડૂતોના ટ્રેક્ટર આંદોલનની કેટલીક આવી જ તસવીરો રોમમાં જોવા મળી હતી. યુરોપમાં ઝડપથી બદલાઈ રહેલા ક્લાઈમેટ ચેન્જને જોતા યુરોપિયન યુનિયને કાયદાઓમાં ઘણા ફેરફારો કર્યા છે. આ સિવાય યુકેન યુદ્ધ શરૂ થયા બાદ સમગ્ર યુરોપમાં માંધવારી વધી છે. ખેડૂતો તેમની આવકમાં ઘટાડો અને વધતી માંધવારીથી ચિંતિત છે. તેમની ફરિયાદો ઈંગ્લેન્ડની કિમ્બોટોથી લઈને યુરોપિયન યુનિયનના પર્લામેન્ટની કાયદાઓ સુધીની છે જે આખોડવા પરિવર્તનને ઘટાડવા માટે રચાયેલ છે. ખેડૂતો માને છે કે સરકારની આ તમામ નીતિઓ તેમની આજીવિકાને નુકસાન પહોંચાડી રહી છે. ખેડૂતોના પ્રતિનિધિઓમાંના એક પિનો કોન્વર્ટિનીએ જણાવ્યું હતું કે, “ખેડૂતો પાસે કિમ્બોટો પર સોદાબાજી કરવાની શક્તિ નથી, અમારી પાસે ઉપરથી કરવામાં આવેલી રાજકીય પરસંદગીઓ પર સોદાબાજી કરવાની શક્તિ નથી. તો આપણે શું કરવું જોઈએ?” ખેડૂતોનું કહેવું છે કે તેમને આખોડવા પરિવર્તનના નિયમોથી દૂર રાખવા જોઈએ અને ખેતીમાં જંતુનાશકોના ઉપયોગ પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. આ વર્ષે યુરોપના ઘણા દેશોમાં ચૂંટણી યોજવાની છે, જેના કારણે આ વિરોધ પ્રદર્શનોને કારણે સરકાર પર ઘણું દબાણ છે. ગયા અઠવાડિયે, યુરોપિયન કમિશને ખેડૂતોને કેટલીક છૂટ પણ આપી છે, ઈટાલીના વડા પ્રધાન મેલોનીએ શુક્રવારે ખેડૂતો સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી, જ્યાં તેમણે ખેડૂતોને ટેક્સમાં છૂટ આપવાનું વચન આપ્યું હતું.

વિંછીયા પંચકમાં સૌની યોજના સહિત  
વિવિધ વિકાસકામોની વાસંતી લહેર,  
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૩૩૭  
કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

રાજકોટ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે રૂ. ૩૩૭.૦૬ કરોડના સૌની યોજનાની લિક-૪ના પેકેજ-૮ સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વિંછીયાના માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં જંગી મેદનીને સંબોધિત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઇવાડાના લોકોને ધ્યાનમાં રાખીને, તેમના માટે યોજના બનાવીને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ પ્રયત્નશીલ છે. અમૃત કાળમાં દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ માટે મુખ્ય ચાર જાતિઓ - ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ - નક્કી કરી છે. ગુજરાતના બજેટમાં પણ આ ચાર જાતિઓના સર્વોચ્ચ વિકાસ માટે અગ્રતા આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, આજનો આ અવસર આ ચાર જાતિઓને વિકાસની નવી દિશા આપતો બહુવિધ વિકાસનો અવસર છે. આજે ૨૧ ડિસેમ્બરના રોજ ૨૮.૮૦ લાખની સાધન સહાય, વિચરતી જાતિના ૧૩૩ લાખથીને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ એ સરકારની ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે. આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમ થકી રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે નવ કરોડનું નવું આઈટીઆઈ ભવન યુવા વિકાસની આપણી નેમ છે. સૌની યોજનાની લિક-૪ના પેકેજ ૮નું કામ રૂ. ૧૮૧ કરોડના ખર્ચે હાથ ધરવાની, ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. જ્યારે રૂ. ૧૩૯ કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો, એ આ વિસ્તારની માતા બહેનોની નારી શક્તિની પાણીની પીડા ભાંગવાનો પ્રયત્ન છે. વડાપ્રધાનશ્રીએ વિકસાવેલી કાર્યપદ્ધતિ “જે બોલવું એ કરવું” તે સિદ્ધાંત પ્રમાણે ગુજરાત સરકાર કાર્ય કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, વિકાસ માટે વિવિધ યોજનાઓ આપવા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાના લાભો છોક નીચે સુધી, ઇલ્લી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચે તેના માટે હરહંમેશ પ્રયત્ન કર્યો છે. જેની ગેરંટીના ભાગરૂપે અને સરકારી યોજનાના લાભો ઇવાડાના લોકોને મળવા જ જોઈએ એવી ગુજરાત સરકારની નેમ સાથે તાજેતરમાં રાજ્યના ગામો સુધી વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા યોજવામાં આવી હતી. આમ યોજનાના લાભોને લોકો સુધી પહોંચાડીને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવું છે.

## વિભીષણનું જીવન વેદના માર્ગ પર છે અને રાવણનું જીવન ભેદભાવના માર્ગ પર છે

પ્રતિકૂળ વર્તનમાં પણ તમારા આચરણનું  
ગૌરવ જાળવવું એ સજ્જનતા કહેવાય છેવિશેષ  
અશાપલકિંદ ટી. વાલેલા  
(દરબાર ગઠ, થરા)

જે જીવન આજે છે તેટલું મધુર છે, તે જીવનમાં સમાન પ્રમાણમાં સંઘર્ષ થયો હશે, આપણે ભૂલી જઈએ છીએ કે જીવનની મધુરતાનું મૂળ સંઘર્ષ છે

તમારા જીવનને વેદ આધારિત બનાવીને જીવો, તેને ભેદભાવ કરીને નહીં. વેદ કહે છે કે બીજા સાથે ક્યારેય એવું વર્તન ન કરો જે તમને પોતાને ગમતું નથી. દરેકને પ્રેમ કરો અને દરેકને માન આપતા શીખો. બીજાઓ સાથે અયોગ્ય વર્તન કરતા પહેલા એ વિચારી લો કે આપણા વર્તનથી કોઈને દુઃખ ન પહોંચે. જો તમે એ પરમાત્માને તમારો આત્મા માનો છો તો એ ભગવાન દરેકમાં વસે છે. પોતાના ફાયદા માટે બીજાને ત્રાસ આપવો એ ભેદભાવની દ્રષ્ટિ છે અને સર્વવ્યાપી હોવાની અનુભૂતિ એ વેદ દ્રષ્ટિ છે. પ્રાર્થના કરતી વખતે ભગવાન મારી નજીક હોય છે અને પાપ કરતી વખતે ભગવાન દૂર હોય છે. કોણ છે તે જોવાની અનુભૂતિ એક અલગ જ દ્રષ્ટિ છે. વિભીષણનું જીવન વેદના માર્ગ પર છે અને રાવણનું જીવન ભેદભાવના માર્ગ પર છે. જે વેદના માર્ગે ચાલે છે તે ભગવાનને પ્રિય બને છે અને જે ભેદભાવના માર્ગે ચાલે છે તે પણ તેને અપ્રિય બને છે. જો ભગવાન ટેવોને સમયસર સુધારવામાં ન આવે તો તે કોઈપણ વ્યક્તિ માટે અભિશાપ બની જાય છે અને તેની બદનામી અને બદનામીનું કારણ બને છે. ભગવાન ટેવોનું પોતાનું વ્યસન પણ હોય છે. જો સમયસર રોકવામાં ન આવે તો તેઓ પણ વ્યસનના શિકાર બની જાય છે. એકવાર આપણે કોઈ ભગવાન આદતના વ્યસની થઈ ગયા પછી, આપણે પોતાને ભગવાન લાગવા છતાં તેને ઠગવાનું બંધ કરી શકીશું નહીં. અમને તે કામ આદતપૂર્વક કરવા માટે દબાણ કરવામાં આવશે. ભગવાન ટેવો એ આપણી પ્રગતિના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. કેટલીક ભગવાન ટેવો આપણા અંગત જીવનને દૂષિત કરે છે, કેટલીક આપણું સામાજિક જીવન દૂષિત કરે છે અને કેટલીક આપણા નૈતિક જીવનને પણ દૂષિત કરે છે. મહાન ફિલસૂફ સોક્રેટિસે લખ્યું છે કે “જો દર વર્ષે એક ભગવાન આદત ને જડમૂળથી કાઢી નાખવામાં આવે છે

અને ફેંકી દેવામાં આવે છે, તો સૌથી ખરાબ વ્યક્તિ પણ થોડા વર્ષોમાં સારી બની શકે છે.” સારી ટેવો સારી વ્યક્તિને જન્મ આપે છે અને ખરાબ ટેવો ખરાબ વ્યક્તિને જન્મ આપે છે. જો તમે ખરાબ આદતો થી બચવા માટે સતત પ્રયત્નો નહીં કરો, તો તમને ખ્યાલ નહીં આવે કે ક્યારે તમારી અંદર કોઈ ખરાબ વ્યક્તિનો જન્મ થઈ ગયો છે. જે જીવનમાં સંઘર્ષ ન હોય ત્યાં સુખ, સમૃદ્ધિ અને શાંતિના મીઠા ફળો મળી શકતા નથી. સંઘર્ષ એક એવું વુજ છે જેના મૂળ કડવા હોય છે પણ તેના ફળ ખૂબ મીઠા હોય છે. જે જીવન આજે છે તેટલું મધુર છે, તે જીવનમાં સમાન પ્રમાણમાં સંઘર્ષ થયો હશે. ઘણીવાર આપણને મીઠાં ફળ જોઈએ છે પણ સંઘર્ષની કડવાશ નો સ્વાદ ચાખવો નથી. આપણે ભૂલી જઈએ છીએ કે જીવનની મધુરતાનું મૂળ સંઘર્ષ છે. જે લોકો આ કડવાશને ટાળવાનો પ્રયાસ કરે છે તેઓ જીવનની મીઠાશથી વંચિત રહે છે. વ્યક્તિના જીવનમાં સંઘર્ષ જેટલો મોટો હશે તેટલી જ તેના જીવનમાં મધુરતા આવશે. પહેલા સંઘર્ષ અને પછી મધુરતા, આ જીવનનો નિયમ છે. ભગવાન શ્રી રામના સંઘર્ષોએ તેમને લોકોના પ્રિય ભગવાન રામ બનાવ્યા, જ્યારે યોગેશ્વર શ્રી કૃષ્ણના સંઘર્ષોએ તેમને મહાન નાયક બનાવ્યા. ક્રમા કરો અથવા ક્રમા માગો, જીવનની ઘણી સમસ્યાઓ આપોઆપ હલ થઈ જશે. કોઈને તેની ભૂલ માટે ક્રમા આપવી એ પણ એક હિંમતવાન અને ટેવો ગુણ છે. આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ ત્યાંથી જ ઊભી થાય છે, જ્યારે આપણી અંદર અહંકારની ભાવના આવી જાય છે કે હું તેને કેમ માફ કરું..? આપણો પોતાનો અહંકાર પછી દુઃશ્મનાવટ અને બદલો લેવાનું કારણ બની જાય છે. કૌટુંબિક જીવન, મિત્રતા જીવન કે સામાજિક જીવનમાં સંબંધોને મજબૂત અને

મધુર બનાવવા માટે આ બેમાંથી એક ગુણ કોઈપણ વ્યક્તિમાં આગવો હોવો જોઈએ. મહાભારતનો પાયો એ સૂત્રના આધારે નાખવામાં આવ્યો હતો કે જો કોઈ માફ કરે તો ક્રમા કોઈની પાસેથી માંગવામાં આવતી નથી. નવા મહાભારતમાંથી છટકી ગયા પછી આપણું જીવન આનંદમાં પસાર થાય તે માટે, આપણે આપણા જીવનમાં એક સૂત્રને સ્થાન આપવું જોઈએ અને તે છે - ક્રમા કરો અથવા ક્રમા માગો. પ્રતિકૂળ વર્તનમાં પણ તમારા આચરણનું ગૌરવ જાળવવું એ સજ્જનતા કહેવાય છે. માત્ર ફૂલની માળા પહેરાવીને ખુશ થવું એ સજ્જનની નિશાની નથી. એક સામાન્ય વ્યક્તિ પણ આ કરી શકે છે. પણ કાંટાનો તાજ પહેર્યા પછી પણ ચહેરા પર સરળતાની લાગણી રહે છે, આ જ ખાનદાની અને મહાનતાની નિશાની છે.

ભુગુજીએ લાત મારી અને માર્યા પછી પણ ભગવાન વિષ્ણુજીએ તેમની માફ માંગી. આ વાર્તાનો અર્થ એ નથી કે તમે સજ્જનોનું અપમાન કરો, પરંતુ એ છે કે જે-તલમેન એ છે જે અન્યની તકલીફોને નમ્રતાથી સહન કરી શકે. જે-તલમેનનો અર્થ આદરણીય વ્યક્તિ નથી પણ આદરની ઈચ્છા વિનાનું વ્યક્તિત્વ છે. જે હંમેશા નમ્રતા અને પ્રેમના આભૂષણોથી શોભતો રહે છે તે સજ્જન છે. જે દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે અને બીજાને ખુશ રાખે છે તે સજ્જન છે. એવા કામ ન કરો કે તમારે બીજાની નજરથી પડવું પડે કારણ કે પહાડ પરથી પડ્યા પછી તમે ફરી ઊભા થઈ શકો છો પણ આંખોમાંથી પડ્યા પછી ઊઠવું આશાન નથી. જેમ મહેલ બનાવવામાં વર્ષો લાગે છે, પરંતુ તેને નષ્ટ કરવા માટે એક ક્ષણ પૂરતી છે. એ જ રીતે, ચારિત્ર્ય ઘડવામાં વર્ષો લાગે છે પણ પાત્રને ઘડવામાં માત્ર એક ક્ષણ લાગે છે. દરેક કાર્ય કરતા પહેલા તેના પરિણામો વિશે વિચારવું એ બુદ્ધિશાળી લોકોની નિશાની છે.

જે વ્યક્તિ પરિવર્તનને અપનાવે છે તે સફળતા હાંસલ કરે છે...

## પસંદગીના ક્ષેત્રમાં મહેનત કરવામાં વ્યક્તિને મજા

કોઈ પણ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા માટે હમ્મેશા નવી નવી ચીજો અને ટેકનોલોજીને અપનાવવા અને તેને અમલી કરવાની બાબત સૌથી મહત્વપૂર્ણ હોય છે. ઈનોવેશનની સાથે આઈગળ વધતા રહેવાથી લાભ થાય છે. જુના કામ કરવાના અંદાજથી આસપાસના લોકોને પણ પરેશાની થાય છે. નોકરીના શ્રેણી પર અને લાઈફમાં પણ સતત ફેરફારોને સ્વીકાર કરીને આગળ વધવાની જરૂર હોય છે. આધુનિક સમયમાં નવી નવી ટેકનોલોજી આવી રહી છે ત્યારે તેને અપનાવવાની જરૂર છે. કોઈ વ્યક્તિએ સચી જ વાત કરી છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને બદલવાનું બંધ કરી દે છે ત્યારે તેની પ્રગતિ સંપૂર્ણપણે રોકાઈ જાય છે. પોતાને સમયની સાથે સતત બદલી નાંખવા માટેના પ્રયાસ કરવા જોઈએ. જેટલી ઝડપથી તમે પોતાને બદલશો તેટલી ઝડપથી વધુ સફળતા હાંસલ થશે. પરિવર્તન સૌથી મહત્વપૂર્ણ બાબત છે. મોટા ભાગના લોકો લાઈફમાં એટલા માટે નિષ્ફળ થઈ જાય છે કે તેઓ પોતાને બદલા માટે ઈચ્છુક હોતા નથી. સી નીલ સ્ટ્રેટ કહે છે કે પરિવર્તન લીક પર ચાલનાર વ્યક્તિ માટે સૌથી મોટી મુશ્કેલ બાબત અનેક હોય છે. કારણ કે વ્યક્તિ પોતાને એ સ્તર સુધી ઘટાડી લે છે જેના પર તે સરળતાથી ચાલી શકે છે. આવી વ્યક્તિ કોઈ પણ પડકાર અને નવી બાબતોને સ્વિકાર કરતા નથી. ભલે તેને પ્રગતિ મળતી હોય તો પણ તે નવી કોઈ બાબતને સ્વિકારશે નહીં. કેટલાક લોકો તો ખાડામાં હોય છે. સાથે સાથે ખોટકામ કરતા રહે છે. તેઓ પોતાના કામના તરીકાને બદલતા નથી



અને મુશ્કેલીમાં ફસાતા જાય છે. કેટલાક લોકો એવા હોય છે જે જિંદી વલણ પર આગળ વધે છે. તેઓ આગળ વધતા નથી. વક્તની આંખી આવા લોકોને ભરબાદ કરી નાંખે છે. કેટલાક લોકો બદલી જવાના બદલે રોકાઈ જવાનું પસંદ કરે છે.

આવા લોકો પણ ક્યાય પહોંચી શકતા નથી. જો કોઈ વ્યક્તિ નવા નવા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ઈચ્છુક છે તો તેમને નવા નવા તરીકે સાથે કામ કરવાની જરૂર રહેશે. પરિવર્તન વગર કોઈ મોટી સફળતા મળી શકે તેમ નથી. બદલાવ સાથે જ સફળતા મળે છે. નિષ્ણાંત લોકો કહે છે કે જો નવા તોરે તરીકાને અપનાવીશું નહી તો નવી નવી સમસ્યા આવતી રહેશે અને સમસ્યા વધારતી રહેશે. કેટલીક વખત સફળતા બિલકુલ નજીક હોય છે પરંતુ સફળતાના રસ્તા પર ચાલવાનો ઈ-કાર કરી દે છે. દુનિયામાં એ જ વ્યક્તિ સફળ થઈ છે જે પરિવર્તનને

સ્વીકારે છે. એક પરિવર્તનની સાથે બીજા પરિવર્તનની રાહ તૈયાર થાય છે. અમને વિકાસની તક મળે છે. પરિવર્તનની ઈચ્છાને હમ્મેશા કાયમ રાખવામાં આવે તે જરૂરી છે. સફળતા હાંસલ કરવા માટે સતત મહેનત કરવામાં આવે તે જરૂરી છે. સતત પરિવર્તનના કારણે અમે ભેગને લીઈ શકીએ છીએ. જો કે પરિવર્તન ન થાય તો અમે ભયભીત થઈ જઈએ છીએ. જો વ્યક્તિ પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતી કર્યા વગર પરિસ્થિતિ સાથે તાલમેળ બેસાડી લે છે તે વ્યક્તિ સફળતા હાંસલ કરે છે. પરિવર્તન ક્યારેય કોઈ એક દિવસમાં થતા નથી. પરિવર્તનના અર્થ લક્ષ્યને હાંસલ કરવા માટે યોગ્ય રસ્તાની શોધ કરવાનો હોય છે. આના માટે સતત મહેનત કરવાની જરૂર હોય છે. પરિવર્તન દરેક રીતે થાય તે જરૂરી છે. વ્યક્તિ પોતાના જીવન મુલ્યોમાં પરિવર્તન લાવે તે કોઈ પરિવર્તન નથી. આધુનિક સમયમાં ચારેબાજુ પડકારની સ્થિતિ રહેલી છે. દરેક જગ્યાએ ગણા કાપ સ્પર્ધા ચાલી રહી છે. સારા લોકોની સાથે રહીને સારી બાબતો શિખવામાં આવે તે ખુબ જરૂરી છે. સમયની માંગ એ છે કે સમયની સાથે નવી નવી ચીજોને અપનાવીને આગળ વધવામાં આવે. આના માટે પોતાની રીતે પણ તૈયારી કરવી જોઈએ. અન્ય લોકોની સલાહને પણ ક્યારેય નજરઅંદાજ કરવી જોઈએ નહીં. તમામની સલાહ સાંભળીને યોગ્ય લાગે તે દિશામાં પહેલ કરવી જોઈએ. બીજા બાબત એ પણ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા સાથે પોતાની પસંદગીના કિલ્ડન પસંદ કરે તો જ તે તેમાં વધારે ઝડપથી આગળ વધી શકે છે.

ચેતવણી : ભોજન વેળા પાણી પાચન શક્તિને ખૂબ નુકશાન છે

## કેટલાક રોગમાં પાણી રામબાણ ઈલાજ

પાણીના મોલને સમજી લેવાની તાકીદની દરેકને પાણી જરૂર છે. પાણી લિક્વિડ એસેટ તરીકે છે. પાણી અમને એ તમામ ચીજો આપે છે જે સારા આરોગ્ય માટે અતિ જરૂરી હોય છે. આજ કારણસર પાણીને લિક્વિડ એસેટ અથવા તો પ્રવાહી સંપત્તિ તરીકે પણ ગણવામાં આવે છે. કારણ કે પાણીથી જ ઉર્જા મળે છે. ગંદકી દૂર થાય છે. અને સમગ્ર સિસ્ટમ એક યુનિટની જેમ કામ કરે છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો લોહી કરતા પણ પહેલા પાણી જરૂરી છે. પાણી પીવાના એક કલાક પહેલા અને પાણી પીવાના એક કલાક બાદ સુધી કોઈ ચીજ વસ્તુઓ ખાવી જોઈએ નહીં. શરૂઆતમાં એક લીટર પાણી પીવાથી તકલીફ થઈ શકે છે. પરંતુ ધીમે ધીમે આની ટેવ પડી જાય છે. પહેલા બે ગ્લાસ પાણી પીવામાં આવે, ત્યારબાદ બે મિનિટ રોકાયા બાદ ફરી બે ગ્લાસ પાણી પીવામાં આવે તે જરૂરી છે. શરૂઆતમાં હેરાનગતિ રહેશે પરંતુ ત્યારબાદ ખુબ ફાયદા રહેલા છે. હકીકતમાં પાણી કેટલાક રોગમાં રામબાણ નુ કામ કરે છે. ભોજન વેળા વધુ પ્રમાણમાં પાણી પીવાર લોકો માટે કેટલીક નવી ચેતવણી જારી કરવામાં આવી છે. આધુનિક સમયમાં મોટાભાગના બાળકો અને મોટી વયના લોકો પણ જમતી વેળા પુરતા પ્રમાણમાં પાણી પીવે છે. પરંતુ નવા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જમતી વેળા અથવા તો ભોજન વચ્ચે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આનાથી પાચન શક્તિને માટી અસર થાય છે.



ભોજન દરમિયાન પાણી પીવાથી પેટની પાચન શક્તિમાં ઘટાડો થાય છે. સાથે સાથે ઈન્સ્યુલીનના પ્રમાણમાં પણ ફેરફાર કરે છે. માર્કેટીલાયોગિક અભ્યાસમાં આ મુજબની ચેતવણી આપવામાં આવી છે. શરીરમાં વધુ પાણી ખૂબ જ જરૂરી છે. પરંતુ જમતી વેળા વધુ પાણીનો ઉપયોગ યોગ્ય નથી. જમવાની સાથે પાણીના પ્રમાણને ઘટાડવામાં આવે તે જરૂરી છે. આનાથી એક બાજુ તરસ છુપાઈ જાય છે પરંતુ પાચન શક્તિને માટી અસર થાય છે. મોટાભાગના બાળકો અને મોટી વયના લોકો હાલના સમયમાં જમતી વેળા એક બે ગ્લાસ પાણી પી જાય છે. મોટાભાગના ભારતીયો પણ તેમના ભોજન માટે પાણી પીવે છે. સામાન્ય થીયોરી એ છે કે જમતી વેળા કુડને સાફ કરી દેવામાં આવે છે. આ પ્રથા ખૂબ જ ખોટી છે. તે વાતથી સામાન્ય લોકો વાકેફ નથી. આનાથી પાચન શક્તિ ઉપર ખૂબ જ અસર થાય છે. પાચન શક્તિની સમસ્યાથી

પીડાઈ રહેલા લોકો માટે ઘણા નવા ઉપાય સુચવવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવાનું છે પેટમાં એ પ્રકારની વ્યવસ્થા છે જે મુજબ જમતી વેળા પાચનની શરૂઆત થઈ જાય છે. જો આ જ વેળા પાણીનો ઉપયોગ કરવામાં આવશે તો આનો મતલબ એ થયો કે પાચન શક્તિની અંદર જે તત્ત્વો રહેલા છે તેને ઘટાડી દેવામાં આવે છે. સંશોધકોનું કહેવું છે કે ભોજન દરમિયાન ઓછું પાણી ચિંતાનું કારણ નથી. પરંતુ એક ગ્લાસ અથવા વધુ પાણી પાચન શક્તિને નુકશાન પહોંચાડે છે. ભોજનના બે કલાક બાદ અથવા પહેલા પાણી પીવાથી ફાયદો થાય છે. આનાથી પોષક તત્ત્વોને સહન કરવાની શક્તિ વધી જાય છે. ભોજન દરમિયાન પાણી પીતી વેળા પ્રક્રિયા કરી પ્રકારની થાય છે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે. ખાવાની ચીજ વસ્તુઓ જ્યારે પેટમાં રહે છે ત્યારે કુદરતી રીતે પાચનની પ્રક્રિયા શરૂ થાય છે. ભોજન વેળા પાણીને ટાળવાની સલાહ આપતા નિષ્ણાંતોનું કહેવું છે કે કેટલીક બાબતોની સલાહના રાખીને તકલીફોને દૂર કરી શકાય છે અને કોઈ કાર્યવાહી કરતુ નથી. માત્ર કાળગ પર કાર્યવાહી કરે છે. ત્રાસવાદીઓના આકાઓ પાકિસ્તાનમાં કેટલીક વખત જાહેરમાં પણ નજરે પડે છે. પાકિસ્તાન હવે ફસાયું છે ત્યારે ભારતને રાજદ્વારી પ્રયાસોને વધારે તીવ્ર કરીને અમેરિકા સહિતના દેશોને સાથે લઈને દાઉદ મામલે પાકિસ્તાનને વધારે ખુલ્લું પાડવાના પ્રયાસ કરવાની જરૂર છે ઈમરાન ખાન સરકારની પ્રતિષ્ઠા પહેલાથી જ ખરાડાયેલી રહેલી છે.



પોઝિટિવ એપ્રોચની સાથે બાળકોને મદદ

# તમારી ભૂલો ખરાબ કરી શકે છે બાળકોની બોર્ડની પરીક્ષા

બોર્ડની એકઝામ જેમ-જેમ નજીક આવી રહી છે જાતના સવાલો અને ડર ઉભો થતો હોય છે. જો કે આ સમયે મોટાભાગના પેરેન્ટ્સ નાની-નાની ભૂલો કરી બેસતા હોય છે જેના કારણે બાળકોને પરીક્ષા સમયે મોટી તકલીફ પડતી હોય છે. આ દરમિયાન બાળકો અને પેરેન્ટ્સ સતત પ્રેશરમાં રહેતા હોય છે. આ સાથે સ્ટ્રેસ લેવલ પણ વધી જાય છે. આ માટે જરૂરી છે કે સૌથી પહેલાં પેરેન્ટ્સે આ આદતો બદલવી જોઈએ જેના કારણે પોતે પોઝિટિવ એપ્રોચની સાથે બાળકોને પણ મદદ કરી શકે. બાળકો ઘણીવાર પરીક્ષાઓને લઈને તણાવમાં રહે છે અને જ્યારે બોર્ડની પરીક્ષાની વાત આવે છે ત્યારે બાળકોની સાથે માતા-પિતાનો તણાવ પણ વધે છે. હવે માર્ચમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. બોર્ડની પરીક્ષા એ માત્ર બાળકોની જ નહીં પરંતુ માતા-પિતાની પણ પરીક્ષા છે. પરીક્ષાના સમયે માતા-પિતા કરતાં વધુ બાળકો ટેન્શનમાં હોય છે. આવી સ્થિતિમાં બાળકોને સમજાવે અને તેમને સપોર્ટ કરો. રોકવા, ટોકવા અને ઠપકો આપવાને બદલે બાળકથી સમજાવો. ઘણીવાર જ્યારે પરીક્ષાઓ આવવાની હોય છે ત્યારે બાળકો અભ્યાસને કારણે માતા-પિતા સાથે ઓછી વાત કરી શકે છે. માતા-પિતા પણ દરેક સમયે ભણવા માટે કહે છે. પણ આવું કરવું ખોટું છે, બાળકોને થોડો સમય આપો અને વાતચીત કરો. બાળક સાથે વાત કરીને સારું બોલિંગ બનાવો, આવી સ્થિતિમાં પરીક્ષાનો તણાવ ઓછો થાય છે.

આ નાની-નાની વાતોનું રાખો ધ્યાન

## મેન્ટલ અને ફિઝિકલ રીતે ફી રહેવા મદદરૂપ

મોબાઇલ લેપટોપ અને ઘણી એવી વસ્તુઓ હોય છે જે બાળકોનું ધ્યાન અભ્યાસ પરથી ભટકાવી દે છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ તે તમામ વસ્તુઓને દૂર રાખવી જોઈએ જે તેમને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે. અભ્યાસની વચ્ચે થોડી-થોડી વારનો બ્રેક પણ ખૂબ જ જરૂરી હોય છે. તેનું પણ ધ્યાન રાખો અને બાળકને બ્રેક લેવા દો. કોઈપણ કામ એનજી વિના થઈ શકતું નથી. આવી સ્થિતિમાં બાળકને એનજી આપવા માટે ડાયટનું ખાસ ધ્યાન રાખો. સંતુલિત આહાર લેવો સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. બાળકના આહારમાં દૂધ, બદામ, લીલા શાકભાજી વગેરેનો સમાવેશ કરો. બાળકને વચ્ચે-વચ્ચે બ્રેક લેવાની સલાહ આપો. વાંચતી વખતે બ્રેક લેવો ખૂબ જરૂરી છે. આમ કરવાથી સ્ટ્રેસ અને થાક બંને ઉતરી જાય છે. આમ, થોડી વાર રમવા જવાનો સમય નક્કી કરો.

# બધું શીખવા અને પ્રેક્ટિસ કરવા વચ્ચે તફાવત છે વિચારવાનું બંધ કરો અને કરવાનું શરૂ કરો: વધુ પ્રેક્ટિસથી સક્ષમ

નિયમિત રીતે હાસ્ય ધ્યાન યોગથી કરવાથી શરીરમાં કેટલાક હકારાત્મક

આપણા બધાના ધ્યેયો છે જે આપણે આપણા જીવનમાં હાંસલ કરવા માંગીએ છીએ. આ ધ્યેયોમાં નવી ભાષા શીખવી, તંદુરસ્ત ખોરાક લેવો અને વજન ઘટાડવું, વધુ સારા માતા-પિતા બનવું, વધુ પૈસા બચાવવા વગેરેનો સમાવેશ થઈ શકે છે. એવું માની લેવું સરળ છે કે તમે અત્યારે ક્યાં છો અને તમે ભવિષ્યમાં ક્યાં બનવા માંગો છો તે વચ્ચેનું અંતર જ્ઞાનના અભાવને કારણે છે. આથી જ અમે બિઝનેસ કેવી રીતે શરૂ કરવો અથવા કેવી રીતે ઝડપ થી વજન ઘટાડવું અથવા ત્રણ મહિનામાં નવી ભાષા કેવી રીતે શીખવી તેના અભ્યાસક્રમો ખરીદીએ છીએ. અમે ધારીએ છીએ કે જો અમને વધુ સારી વ્યૂહરચના વિશે ખબર હોત, તો અમને વધુ સારા પરિણામો મળશે. અમે માનીએ છીએ કે નવા પરિણામ માટે નવા જ્ઞાનની જરૂર છે. જો કે, હું જે અનુભવવા લાગ્યો છું તે એ છે કે નવું જ્ઞાન જરૂરી નથી કે નવા પરિણામો લાવે. વાસ્તવમાં, જો તમારું ધ્યેય પ્રગતિ કરવાનું છે અને ફક્ત વધારાનું જ્ઞાન મેળવવાનું નથી, તો કંઈક નવું શીખવું એ ખરેખર સમયનો વ્યય બની શકે છે. તે બધું શીખવા અને પ્રેક્ટિસ કરવા વચ્ચેના તફાવત પર આવે છે.



“જ્યારે આપણે કંઈક પ્રેક્ટિસ કરીએ છીએ, ત્યારે આપણે ચોક્કસ ધ્યેય સુધી પહોંચવાના હેતુ સાથે પ્રક્રિયાના ઈરાદાપૂર્વક પુનરાવર્તનમાં સામેલ હોઈએ છીએ. ઈરાદાપૂર્વક અને ઈરાદા શબ્દો અહીં ચાવીરૂપ છે કારણ કે તેઓ કંઈક સક્રિય રીતે પ્રેક્ટિસ કરવા અને તેને નિષ્ક્રિય રીતે શીખવા વચ્ચેના તફાવતને વ્યાખ્યાયિત કરે છે. કંઈક નવું શીખવું અને કંઈક નવું પ્રેક્ટિસ કરવું તે ખૂબ સમાન લાગે છે, પરંતુ આ બે પદ્ધતિઓના પરિણામો ખૂબ જ અલગ હોઈ શકે છે. તફાવત વિશે વિચારવાની અહીં કેટલીક વધારાની રીતો છે.

## હાર્ટ અટેકના ખતરાથી ક્ષય રીતે બચી શકાય

આધુનિક ભાગદોડની લાઈફમાં કેટલીક સાવધાની જરૂરી બની ગઈ છે. સીટિંગ ડિસીઝનો ખતરો હાર્ટ પર સૌથી વધારે રહે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અન્ય એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હાર્ટની બિમારીઓને દૂર રાખવા માટે વેજિટેરિયન યીજવસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે વેજિટેરિયન છો તો આ અભ્યાસના તારણો તમારા માટે ખૂબ સારા છે અને મોટી રાહત આપી શકે છે. વેજિટેરિયન ભોજનથી હાર્ટની બિમારીઓનો ખતરો ઉલ્લેખનીય રીતે ઘટી જાય છે. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના ૪૪૫૦૦ લોકોને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. હાર્ટ પર સૌથી વધારે

આપે છે. કોઈ અન્યને પાણી પિવડાવવાનું કહેવાના બદલે પોતે ઉભા થઈને પાણી પીવું જોઈએ અને ફાઈલ સહિતની ચીજો પણ ખાતે જ ઉભા થઈને લેવી જોઈએ. આના કારણે શરીર સતત સક્રિય રહે છે. થોડાક થોડાક અંતરે ઉભા થઈને શરીરને આરામ આપવા માટે પ્રયાસ કરવા જોઈએ. સાથે સાથે બેસવાની રીત પણ બદલવી રહેવાની જરૂર હોય છે. નિયમિતરીતે કસરત કરવાની ટેવ પાડવાની તમામને સલાહ આપવામાં આવે છે. નિયમિતરીતે દરરોજ અડધા કલાક સુધી કસરત કરવાથી શરીરને ફાયદો થાય છે. આનાથી શરીર સ્વસ્થ રહે છે. નિયમિતરીતે કસરત ન કરનાર અને વધારે સમય સુધી બેસી રહેનાર પર હાર્ટ અટેકનો ખતરો વધારે રહે છે



# BOLLYWOOD NEWS FLASH

## મેં શાહરૂખ જેવો મહેનતું માણસ ક્યારેય જોયો નથી : જોની લીવર

જોનીની આગામી ફિલ્મ લંતરા છે જે OTT પર રિલીઝ થશે : આમાં જોની હવાલદારના રોલમાં જોવા મળશે

ફેમસ કોમેડિયન જોની લીવરે ૯૦ના દાયકાની ઘણી ફિલ્મોમાં કિંગ ખાન સાથે કામ કર્યું છે. હવે એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખે આ વિશે વાત કરી છે. શાહરૂખનો ઉલ્લેખ કરતા જોનીએ કહ્યું કે આ વ્યક્તિ પોતાની મહેનતના કારણે આ પદ સુધી પહોંચ્યો છે. જોની લીવરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘જ્યારે અમે બાજીગરમાં સાથે કામ કર્યું ત્યારે હું શાહરૂખ કરતાં વધુ

જાણીતો હતો. શૂટિંગ દરમિયાન પણ લોકો મને વધુ ઓળખતા હતા. ત્યારે હું સ્ટાર હતો. ત્યારે શાહરૂખનો યુગ શરૂ થઈ ગયો હતો પરંતુ અમારી વચ્ચે હંમેશા અદ્ભુત સમજણ હતી. જોનીએ ઈન્ટરવ્યૂમાં વધુમાં કહ્યું, મેં અક્ષય કુમારને પણ જોયો છે... તેઓ પણ ખૂબ મહેનત કરે છે પરંતુ મહેનત- મહેનતમાં ફરક છે. શાહરૂખ ખાનફાઈટમાં નબળો હતો અને ડાન્સમાં પણ નબળો હતો. પણ ધીમે ધીમે છોકરો બધું શીખી ગયો. તેના જેવો મહેનતુ છોકરો મેં ક્યારેય જોયો નથી. શાહરૂખના કામ પ્રત્યેના સમર્પણને લગતી એક ઘટના જણાવતા જોનીએ કહ્યું, અમે મહેનતુ સ્ટુડિયોમાં બાદશાહ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને આસપાસ હજારો સુંદર છોકરીઓ હતી. છોકરીઓમાં તેના વિશે એટલો કેલ છે કે તેઓ શાહરૂખને જોઈને પાગલ થઈ જાય છે. સેટ પર આટલી બધી છોકરીઓ હોવા છતાં તે વિચિત્ર છે કે શાહરૂખનું ધ્યાન કામ પરથી હટી ગયું હશે. તે પોતાના કામમાં સંપૂર્ણ મગ્ન રહ્યો. જોનીની



આગામી ફિલ્મ લંતરા છે જે OTT પર રિલીઝ થશે. આમાં જોની હવાલદારના રોલમાં જોવા મળશે. જોની ૧૯૯૨માં રિલીઝ થયેલી ફિલ્મ યમહાદારમાં શાહરૂખ સાથે કરિયરમાં પહેલીવાર કામ કર્યું હતું. આ પછી શાહરૂખ સાથે બાજીગર, બાદશાહ, રાજુ બન ગયા જેન્ટલમેન અને કુછ કુછ હોતા હૈ સહિત ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. બંનેએ છેલ્લે ૨૦૧૫માં રિલીઝ થયેલી ‘દિલવાલે’માં સાથે કામ કર્યું હતું.

## યોદ્ધા ફિલ્મનું ટીઝર ૧૬ ફેબ્રુઆરીએ અને ફિલ્મ ૧૫ માર્ચના રોજ રિલીઝ થશે

સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ ‘યોદ્ધા’ના નિર્માતાઓએ ૧૩ હજાર ફૂટની ઊંચાઈએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. મેક્સ સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરીને આ માહિતી આપી હતી. જેમાં પ્રોફેશનલ સ્કાય ડાઈવર્સ દુબઈના પામ આઈલેન્ડ પર ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરતા જોવા મળ્યા હતા. પ્રોફેશનલ સ્કાય ડાઈવર્સ સાથે મળીને દુબઈના પામ આઈલેન્ડ પર ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પહેલીવાર છે જ્યારે કોઈ બોલિવૂડ ફિલ્મનું પોસ્ટર ૧૩ હજાર ફૂટની ઊંચાઈ પર લોન્ચ કરવામાં આવ્યું છે. મેક્સ હવે ૧૯ ફેબ્રુઆરીએ ફિલ્મનું ટીઝર રિલીઝ કરશે. સિદ્ધાર્થ મલ્હોત્રા, દિશા પટણી અને રાશિ ખન્ના પહેલીવાર ફિલ્મ ‘યોદ્ધા’માં સાથે જોવા મળશે. આ એક એક્શન ફિલ્મ છે જે કરન જોહર દ્વારા બનાવવામાં આવી છે. તેનું દિગ્દર્શન સાગર અંબે અને પુષ્કર ઓઝાએ કર્યું છે. આ ફિલ્મ અગાઉ ગયા વર્ષે ૭ જુલાઈએ રિલીઝ થવાની હતી. આ પછી, નિર્માતાઓએ

તેને ૮ ડિસેમ્બરે રિલીઝ કરવાની યોજના બનાવી હતી પરંતુ તેમ છતાં તે રિલીઝ થઈ શકી ન હતી. હવે તે આખરે આ વર્ષે ૧૫ માર્ચે રિલીઝ થશે.



## આલિયા ભટ્ટ પ્રોડક્શનની સીરીઝ પોચરનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

હાથીઓની થતી નિર્મમ હત્યા ઉપર બની છે આ સીરીઝ, ૮ એપિસોડની સીરીઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે

એમેઝોન પ્રાઈમ વીડિયોની નવી સીરીઝ પોચરનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. સીરીઝને એમી એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર રિચી મેહતાએ બનાવ્યું છે. સાથે જ તેની કહાનીને લખ્યું અને ડાયરેક્ટ પણ રિચીએ જ કર્યું છે. આ સીરીઝમાં નિમિષા સજયન, રોશન મેથઅયૂ અને દિબ્યેંદુ ભટ્ટાચાર્ય મુખ્ય ભૂમિકાઓમાં નજર આવશે. ‘પોચર’નું નિર્માણ ઓસ્કર વિજેતા પ્રોડક્શન અને ફાઈનલેસ કંપની ક્યૂસી એન્ટરટેઈનમેંટે કર્યું છે જેણે હોલીવુડના ફેમસ એક્ટર અને ડાયરેક્ટર જોર્જન પીલની ‘ગેટ આઉટ’ અને સ્પાઈક લીની ‘બેલકલાસમેન’ જેવી હિટ ફિલ્મો આપી છે. સાચી ઘટનાઓ પર આધારિત પોચર આઠ એપિસોડની કાર્ટમ ડ્રામા સીરીઝ છે. તેના ટ્રેલરમાં હાથીઓની નિર્દયી ઘટનાની ઝલક દેખાડવામાં આવી છે. તેમાં તમે વન્યજીવ સંરક્ષકોનું એક યુગ જોશો જેમાં





# અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટડા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે

અમદાવાદ, તા.૧૬ | ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટડા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ થી ચાલશે જેની વિગતો નીચે મુજબ છે. ● ૧૮, ૨૫ ફેબ્રુઆરી અને ૦૩, ૧૦, ૧૭ માર્ચ ૨૦૨૪ના અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર ૧૮૪૧૫ અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટડા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા જાલંધર-મુકેરિયા-પદાણકોટના રસ્તે ચાલશે. આ ટ્રેન બ્યાસ, અમૃતસર અને બટાલા સ્ટેશનો પર નહીં જાય.

● ૨૦, ૨૭ ફેબ્રુઆરી અને ૦૫, ૧૨, ૧૯ માર્ચ ૨૦૨૪ ના શ્રી માતા વૈષ્ણો દેવી કટડાથી ચાલતી ટ્રેન નંબર ૧૮૪૧૬ શ્રી માતા વૈષ્ણોદેવી કટડા -અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પદાણકોટ-મુકેરિયા-જાલંધરના રસ્તે ચાલશે. આ ટ્રેન બટાલા, અમૃતસર અને બ્યાસ સ્ટેશનો પર નહીં જાય. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો. [www.enquiry.indianrail.gov.in](http://www.enquiry.indianrail.gov.in) પર જઈને અવલોકન કરી શકે છે

# ધરમપુરના ઓઝરપાડામાં દેશીગાય આધારિત પ્રાકૃતિક ખેતી ઉપર સેમિનાર યોજાયો



ધરમપુરના ઓઝરપાડામાં દેશીગાય આધારિત પ્રાકૃતિક ખેતી ઉપર સેમિનાર યોજાયો ધરમપુરના ઓઝરપાડાના અંબામાતા મંદિરના પટાંગણમાં આત્મા પ્રોજેક્ટ પ્રેરિત અને દીપ જ્યોતિ સેવા મંડલ ઓઝરપાડા દ્વારા આયોજિત નિવૃત્ત પ્રધ્યાપક વજીરભાઈ ડી. હરકણિયાના અધ્યક્ષસ્થાને એક દિવસીય દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિષયક સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ અને આત્મા પ્રોજેક્ટના વિશેષ પ્રોજેક્ટ ડાયરેક્ટર ધીરેનભાઈ પટેલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિસ:અયક વિશદ યર્ચા કરી હતી. દેશી ગાયના છાણ - મૂત્ર આધારિત ખાતર બનાવટ અને તેના ફાયદાઓ વણ્યા હતા. પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ હસમુખભાઈ સી. પટેલે દેશીગાયના મળ-મૂત્ર માંથી બનતા ખાતરની પ્રાયોગિક રીત બતાવી હતી. બીજામુત, જીવામૃત, ધનજીવામૃત વગેરેના વિવિધ લાભો વર્ણવ્યા હતા. તેમણે સફળ રીતે કરેલી પ્રાકૃતિક ખેતીના પાકોનું નિદર્શન પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોમાં ડો. મહાવીરસિંહ રાવલ, રમેશભાઈ પટેલ, પરેશભાઈ લાડ તથા ખંડુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના સ્વાનુભાવો જણાવ્યા હતા. આ પ્રસંગે ડી.ડી.ઓ. વિમલકુમાર એચ. પટેલ, એડવોકેટ વિનોદભાઈ આર. પટેલ, બેંક ઓફ બરોડાના નિવૃત્ત ચીફ ઓફિસર ભુપેન્દ્રભાઈ પટેલ, જગુભાઈ બી. પટેલ, મહેશભાઈ બી. પટેલ ઉપરાંત ગામના તથા અન્ય ગામોના આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ દરેક ખેડૂતે ઘરે ઘરે દેશી ગાય રાખવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સી.આર.સી. કક્ષાના શ્રેષ્ઠ શિક્ષિકા ફાલ્ગુનીબેન એસ. પટેલે કર્યું હતું.

# મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રીઓ સહિત ધારાસભ્યઓ ગબ્બરની તળેટી ખાતે મહા આરતીમાં સહભાગી થયા



ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨થી ૧૬ મી ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ભવ્ય આયોજન કરાયું છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવ પૂર્વક દર્શન કરી આરતી- પૂજન-અર્ચન કર્યા હતા. આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યોશ્રીઓ ઉપસ્થિત રહીને દર્શન- આરતીમાં સહભાગી થયા હતા. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદભુત નજારો ઊભો કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રીશ્રીઓ સહિત ધારાસભ્યશ્રીઓ ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા. ત્યારબાદ સૌ કોઈ માતા સતિના જીવન

પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓએ ગરબા રમીને ધન્યતા અનુભવી હતી. આ અવસરે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષા વૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલાં ૨૧ જેટલાં બાળકો ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયાં હતાં. આ સ્થળે મહિલા સ્વસહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્ત કલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રીશ્રીઓ સર્વશ્રી ઋષિકેશ પટેલ, શ્રી ભવંતસિંહ રાજપૂત, શ્રી મૂળુભાઈ બેરા, શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર, શ્રીમતી ભાનુબહેન બાબરીયા, શ્રી હર્ષ સંઘવી, સાંસદશ્રી પરબતભાઈ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

# પોરબંદરના વસંતપંચમીના દિવસે જન્મેલ દિકરીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિકરી વધામણા કીટ અપાઈ

પોરબંદર, તા.૧૬ | વસંતપંચમીના દિવસે જન્મેલ દિકરીઓને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા લેડી હોસ્પિટલ-પોરબંદર તેમજ ચોપાટી કલ્યાણ ગ્રાઉન્ડ ઝૂપડપટ્ટી વિસ્તારમાં પહોંચી 'ડીસ્ટ્રીક્ટ હાઇ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન' યોજનાના કર્મચારીઓ દ્વારા દિકરીઓને "બેટી બચાવો બેટી પઢાવો યોજના" અંતર્ગત દિકરી વધામણા કીટ દિકરીઓના વાલીને આપી હતી. તેમજ હાલી દિકરી યોજનાનું ફોર્મ આપવામાં આવ્યું હતું. પરિવારજનોને દિકરા-દિકરી એક્સમાનનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો. જે.સી.ગોહિલ તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.

# પી.એમ. કિસાન યોજના હેઠળ પોરબંદર જિલ્લાના લાભાર્થીઓના ઈ-કેવાયસી માટે ઝુંબેશ હાથ ધરાઈ

પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા ૧૫મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરાઈ છે. આથી, પોરબંદર જિલ્લાના જે લાભાર્થી અને ૧૫ મો હપ્તો મળેલ ન હોય તો ૧૫ મો હપ્તો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું રહેશે. સરકારશ્રી દ્વારા તા. ૧૨ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે ૧૦-દિવસીય રાષ્ટ્રવ્યાપી "eKYC" માટેની ઝુંબેશ હાથ ધરાશે. જેનું ઈ-કેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષા/અનજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવાયું છે. ઉપરાંત અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી/તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રીની કચેરીએ ઝૂબડું ઉપસ્થિત રહી ફેસઓથેન્ટિકેશનદ્વારા "eKYC" કરાવી શકશે.

# જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ



આણંદ, તા.૧૬ | આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસ.એસ.હોસ્પિટલ પેટલાદ ખાતે આરશ્નોસ્કોપિક સર્જરીની સારવાર માટે આવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓને આ સર્જરીની આધુનિક અને અસરકારક સારવાર ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી આણંદ જિલ્લાના નિષ્ણાંત આરશ્નોસ્કોપિક સર્જન ડો. ધવલ ભાટીયા અને લેપ્રોસ્કોપિક સર્જન ડો. જીગર મોદીને એસ.એસ.હોસ્પિટલ પેટલાદ ખાતે નિમણૂક આપવામાં આવી હતી. આ બેઠકમાં લેવાયેલ નિર્ણયના પરિણામે એસ.એસ.હોસ્પિટલ પેટલાદ ખાતે આવતા સાંધાની આરશ્નોસ્કોપિક સર્જરી, એપેન્ડિક્સ, સારણગાંઠ, પીતાશયની પથરી વગેરેના દર્દીઓ લેપ્રોસ્કોપિક સર્જરી દૂરબિનથી કરી શકાશે તેમ એસ.એસ.હોસ્પિટલ, પેટલાદના સી.ડી. એમ.ઓ. ડો. ગિરીશ કાપડીયાએ જણાવ્યું છે. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. દિપક પરમાર, જનરલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. ડો. અમર પંડ્યા અને સહિત જિલ્લા રોગી કલ્યાણ સમિતિના સદસ્યો હાજર રહ્યાં હતાં.

આપવામાં આવી હતી. આ બેઠકમાં લેવાયેલ નિર્ણયના પરિણામે એસ.એસ.હોસ્પિટલ પેટલાદ ખાતે આવતા સાંધાની આરશ્નોસ્કોપિક સર્જરી, એપેન્ડિક્સ, સારણગાંઠ, પીતાશયની પથરી વગેરેના દર્દીઓ લેપ્રોસ્કોપિક સર્જરી દૂરબિનથી કરી શકાશે તેમ એસ.એસ.હોસ્પિટલ, પેટલાદના સી.ડી. એમ.ઓ. ડો. ગિરીશ કાપડીયાએ જણાવ્યું છે. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. દિપક પરમાર, જનરલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. ડો. અમર પંડ્યા અને સહિત જિલ્લા રોગી કલ્યાણ સમિતિના સદસ્યો હાજર રહ્યાં હતાં.

# જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં ઊર્જા સંરક્ષણ વિશે જાગૃતતા અને ઊર્જા મિત્ર-હોમ વાન પ્રદર્શન યોજાયું

ગુજરાત સરકારના ક્વાઈટમેટ એન્જ વિભાગ હસ્તકના ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA) ગાંધીનગરના માર્ગદર્શનમાં જયભારતી ફાઉન્ડેશન દ્વારા જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ, લસકણામાં "ઊર્જા સંરક્ષણ વિશે જાગૃતતા અને ઊર્જા મિત્ર-હોમ વાન પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ઊર્જા વિશે, તેના પ્રશ્નો, સંરક્ષણ/બચતની જરૂરિયાત/આવશ્યકતા, ઊર્જા સંરક્ષણ દ્વારા પર્યાવરણ સુરક્ષા, ગ્લોબલ વર્મિંગ/ ક્લાઈમેટ એન્જના કારણો અને અસરો પ્રત્યે જાગૃતિ કેળવાય, ઊર્જાનો કાર્યક્ષમ અને વિવેકપૂર્વક ઉપયોગ, પુન:પ્રાપ્ત/હરિત જેવા ઊર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતો, કાર્યક્ષમ ઉપકરણોના ઉપયોગ દ્વારા ઊર્જાની કટોકટીને અમુક અંશે નિવારી શકાય જેવા મુદ્દાઓ પર મોબિ/PPPT માર્ગદર્શન વાર્તાલાપ, પ્રદર્શન વાનમાં ડિસ્કેલ કરવામાં આવેલ ઈલેક્ટ્રિક સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, પાવર સેવર પેનલ દ્વારા ડેમોસ્ટ્રેશન, શોર્ટ વિડીયો/ ફિલ્મ, પ્રશ્નોત્તરી વગેરે પ્રવૃત્તિ



દ્વારા પ્રોગામ કો-ઓર્ડિનેટર/તજજ્ઞશ્રી જી.એન. કાકડિયા અને વેદાંત ફાઉન્ડેશનના પ્રમુખ રાઘવજીભાઈ વેકરીયાએ ઊંડાણમાં સમજ આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં એમ.ડી શ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ, તમામ વિભાગનાં આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છીએ કે, આ શાળામાં હાલ ૪૫૦ કિલો વોટ સોલાર પાવર પ્લાન્ટના ઈન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે, જેના ઉપયોગ થકી સંસ્થાની જરૂરી તમામ વીજળીની જરૂરિયાત આ સોલાર પાવર પ્લાન્ટથી મળી રહેશે, જેનાથી સમગ્ર શાળા ગ્રીન શાળા તરીકે ઓળખાશે.

# કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા ખાતે રાજકોટ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

"પ્રાકૃતિક કૃષિ આધુનિક સમયની માંગ" : કૃષિ વૈજ્ઞાનિક ડો. જે. એચ. ચૌધરી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા ખાતે રાજકોટ જિલ્લાના ૬ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિ વૈજ્ઞાનિક ડો. જે.એચ.ચૌધરીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ આધુનિક સમયની માંગ છે. પોષણયુક્ત-કેમિકલ મુક્ત ખોરાકને આવાનારી પેઢી માટે ખૂબ આવશ્યક છે. ડો. જે. એચ. ચૌધરી દ્વારા પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મને કેવલોપ કરી ૭૬ ખેડૂતો સાથે ગોષ્ઠિ કરવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતીમાં પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ અંગેના સમાધાન અને વિવિધ ઉપચારો વિશે માહિતી આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એચ.ડી.વાદીએ ખેડૂતોના પ્રાકૃતિક ઉત્પાદનના પૃથ્થકરણ કરવા અંગે સરકારી સહાય અને



સબસીડી વિશે તથા શ્રી હિતેશ ગીણોયા દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ફાર્મ GOPCAમાં રજીસ્ટ્રેશન કરવા અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કુ. પાયલ ટાંક અને શ્રી અરવિંદ બેરાણીએ કર્યું હતું. પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એમ. તાજપરા તથા અન્ય વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.

# શરીર હિમાલયથી ભલે ઘાયલ પણ મન નવા શિખરો સર કરવા મક્કમ

નિશાકુમારી વડોદરાની પ્રથમ અને સફળ એવરેસ્ટ આરોહક છે. વિશ્વના આ સૌથી ઉંચા અને બરફથી ઢંકાયેલા શિખરના આરોહણ દરમિયાન નિશાને બરફના ઝંઝાવાતી તોફાનોનો સામનો કરવો પડ્યો હતો અને હિમ દંશથી તેના બંને હાથની આંગળીઓ ખૂબ ખરાબ રીતે ઢાઝી હતી.લાંબી અને ખર્ચાળ સારવાર બાદ તેનો ઈજાઓ માંથી ઉગારો થયો હતો. હજુ પણ હિમાલયના આ આકરા ધા માંથી એ પૂરેપૂરી સાજી થઈ નથી. ઈજાના નિશાન એણે વેઠેલી દારુણ વેદનાઓની ગવાહી આપે છે.એનું શરીર ભલે હજુ હિમાલયના ધા થી મુક્ત થયું નથી તેમ છતાં,

મક્કમ અને અડગ મન ને હિમાલય નડતો નથી એ ઉકિતને અનુસરીને નિશા વધુ એકવાર ગઢવાલ રેંજના ચારેકોર બરફથી છવાયેલા શિખરોની ગોદમાં પહોંચી ગઈ છે. યાદ રહે કે વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતા હોય એવા સાત શિખરો છે અને તે જુદા જુદા દેશો અને ખંડોમાં આવેલા છે અને મોટેભાગે બરફની અત્યંત જાડી ચાદર હેઠળ ઢંકાયેલા રહે છે. અહંત પર્વતારોહકની અભિલાષા એવરેસ્ટ ઉપરાંત અન્ય ૬ શિખરો સર કરવાની હોય છે જે સેવન પિક સમિટ તરીકે ઓળખાય છે. નિશા કુમારીની અભિલાષા પણ સ્વાભાવિક રીતે જ એવરેસ્ટથી ઉતરતા કમની ઊંચાઈ ધરાવતા અન્ય ૬ શિખરો પર ત્રિરંગો ફરકાવવાની છે.

# આજનું રાશિ ભવિષ્ય.....

**મેષ (અ,વ,ઇ) :** આજના દિવસે લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પુરી શક્યતા છે. તમે જો પાર્ટી કરવાની યોજના ધરી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો.

**વૃષભ (બ,વ,ઉ) :** આજના દિવસે લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પુરી શક્યતા છે. તમે જો પાર્ટી કરવાની યોજના ધરી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો.

**મિથુન (ક,ઇ,ઘ) :** આજના દિવસે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે. આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવા ની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે. બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે.

**તુલા (ર,ત) :** આજના દિવસે તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અટકાવ સમય મળશે. તમારી પાસે અંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો.પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો.

**કર્ક (ડ,ઢ) :** આજના દિવસે તમારા ખાભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો. તમારા જીવનસાથીની તબિયત તાજા તથા બેચેનીનું કારણ બની શકે છે.

**સિંહ (મ,ર) :** આજના દિવસે જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. પોતાના જીવનસાથી જેડે તમે આજે ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે.

**કન્બા (પ,ઘ,ઙ) :** આજના દિવસે તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી શણગાર લાવશે. આજે તમારા હાથ માં ધન નહિ ટકે, ધન સંચય કરવા માં આજે તમને ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડશે? પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે. તમે આજે તમારા મહત્વપૂર્ણ કાર્યો નો નિકાલ કરી ને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો.

**મકર (બ,જ) :** આજના દિવસે તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાવ. તમારા માતા પિતા આજે તમારી ફિજૂલખર્ચી જોઈ ચિંતિત થયી શકે છે અને તમને તેમના ગુસ્સા નો ભોગ બનવો પડી શકે છે. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. આજે રોમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન ઊડે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે.

**કુંભ (ગ,ઘ,ઙ) :** આજના દિવસે ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થયી શકે છે. આજે તમે સારી ભવત કરવા માટે સમર્થ હશો. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી આંખ કાઢી લેશો. આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાત ને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો.

**મીન (દ,ઝ,ઞ,થ) :** આજના દિવસે તબિયત પર ધ્યાન આપવું પડશે. જો તમે પરિણીત છો તો આજે પોતાના બાળકો નું વિશેષ ખ્યાલ રાખો કેમકે જો તમે આવું નહિ કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. તમારું પૂંખવું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે. અ



ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં બેટરનું શાનદાર ડેબ્યું

# સરફરાઝ ટેસ્ટ કેપ આપનારા કુંબલેની જેમ જ ડેબ્યુ ટેસ્ટમાં રનઆઉટ થયો

## અનિલ કુંબલેએ પણ ૯ ઓગસ્ટ ૧૯૯૦ના રોજ માન્યેસ્ટરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યુ સમયે રન આઉટ થયા હતા

! (એજન્સી) રાજકોટ, તા.૧૬ ।

રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની શરૂઆત સાથે કારકિર્દીની શરૂઆત કરનાર સરફરાઝ ખાને ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. સરફરાઝે તેની કારકિર્દીની પ્રથમ ઈનિંગમાં કરોડો ચાલકોને સ્પષ્ટ કરતું હતું કે તે ડોમેસ્ટિક મેચ જે રીતે રમે છે એ જ અંદાજમાં ટેસ્ટ મેચ પણ રમી શકે છે. આ મેચમાં સરફરાઝે ૪૮ બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

ઈંગ્લેન્ડના બોલરો સામે તેણે ૬૬ બોલ પર ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૬૨ રન બનાવ્યા હતા. આ યુવા ક્રિકેટર જબરદસ્ત રમ્યો હતો, જોકે, તે થોડો કમનસીબ હતો અને રવિન્દ્ર જાડેજાના ખોટા કોલને કારણે નોન-સ્ટ્રાઈકર છેડે રનઆઉટ થયો હતો. સરફરાઝ તેના ડેબ્યુમાં રનઆઉટ થયા બાદ પણ ભારતના ભૂતપૂર્વ ટિગ્ગર અને તેને ડેબ્યુ કેપ આપનાર વ્યક્તિ અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી કરી હતી. સરફરાઝ પહેલા અનિલ કુંબલેએ પણ ૯ ઓગસ્ટ ૧૯૯૦ના રોજ માન્યેસ્ટરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ



ડેબ્યુ કર્યું હતું. અનિલ કુંબલે પણ સરફરાઝ જેમ જ તેના પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં જ રનઆઉટ થયો હતો. આ રીતે રન આઉટ થકી બંને ક્રિકેટર વચ્ચે એક ખાસ કનેક્શન બન્યું છે. જોકે કુંબલે તેની પ્રથમ ટેસ્ટ ઈનિંગમાં માત્ર ૨૨ જ બનાવી શક્યો હતો, જે

## આનંદ મહિન્દ્રાની સરફરાઝ ખાનના પિતાને યારની ઓફર

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રા એ રાજકોટ ટેસ્ટ માં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાન અને તેના પિતા નોશાદ ખાનની પ્રશંસા કરી છે. આનંદ મહિન્દ્રાએ સરફરાઝ ખાનના પિતા નોશાદ ખાનને મોટી ભેટ આપવાની ઓફર પણ કરી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે 'જે સરફરાઝના પિતા ભેટ સ્વીકારશે તો મને સાક લાગશે.' આનંદ મહિન્દ્રાએ નોશાદ ખાનને યાર આપવાની ઓફર પણ કરી છે. તેઓ ઘણી વખત ખેલાડીઓ માટે આર્પુ કરે છે. જોકે, કેટલાક પ્રસંગોમાં ખેલાડીઓના માતા-પિતા પણ આ રીતે પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. સરફરાઝ ખાનની સફળતામાં પિતા નોશાદ ખાને કેટલી મહત્વની ભૂમિકા ભજવી તે સૌ કોઈ જાણે છે. આ જ કારણ છે કે આનંદ મહિન્દ્રા નોશાદની મહેનતને ઓળખીને તેમને ભેટ આપવાની વાત કરી છે. આનંદ મહિન્દ્રાએ આજે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને સરફરાઝ ખાન અને તેના પિતાની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે લખ્યું હતું કે, 'હિંમત હારશો નહીં, બસ! વધુ મહેનત, સાહસ, અને ધીરજ એક પિતા માટે બાળકને પ્રેરણા આપવા માટે આનાથી વધુ સારા ગુણ શું હોઈ શકે? એક પ્રેરણાદાયી માતા-પિતા હોવાના કારણે, જે નોશાદ ખાન યારની ભેટ સ્વીકારશે તો તે મારા માટે સોભાગ્ય અને સન્માનની વાત હશે.'

સામે બાઉન્સર માર્યો. આ જોઈને જાડેજાએ તેને ધીરજ રાખવા કહ્યું. પરંતુ રવિન્દ્ર જાડેજા ની ભૂલના કારણે સરફરાઝ રન આઉટ થયો હતો અને વિવાદ સર્જાયો હતો. જોકે આ વિવાદ બાદ જાડેજાએ પોતાની ભૂલ સ્વીકારતા લખ્યું કે, 'સરફરાઝ માટે દુઃખ થયું, મેં

ખોટો કોલ આપ્યો હતો.' સરફરાઝ ખાનને ટેસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય સ્પિન બોલર અનિલ કુંબલે દ્વારા ડેબ્યુ ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યુ ટેસ્ટ કેપ લઈને કુંબલેના રેકોર્ડની બરાબરી કરવી એક રસપ્રદ સંયોગ છે.

ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ મેચ- દિવસ-૨

## ડ્યુકેટની શાનદાર સદી સાથે ભારત સામે ઈંગ્લેન્ડની વળતી લડત, ૨૦૭/૨

! (એજન્સી) રાજકોટ, તા.૧૬ ।

બેન ડ્યુકેટના શાનદાર નો.આ. ૧૩૩ રનની મદદથી પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંત સધીમાં બે વિકેટના ભોગે ૨૦૭ રન બનાવી લીધા હતા. દિવસની રમતના અંતે ડ્યુકેટ સાથે જો રૂટ નવ રને રમતમાં હતો.

ભારતે આજે ગઈકાલના પાંચ વિકેટે ૩૨૬ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને ગઈકાલે શાનદાર સદી ફટકારનારો રવીન્દ્ર જાડેજા તેના ગઈકાલના રસ્કોરમાં માત્ર બે રન વધુ ઉમેરીને ૧૧૨ રને રૂટને વળતો કેચ આપી બેઠો હતો. જોકે એ પછી ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અચિને સારી લડત આપતા સાતમી વિકેટની ભાગીદારીમાં ૭૭ રન ઉમેર્યા હતા. ભારતની ઈનિંગ્સ ૪૪૫ રનમાં સમેટાઈ ગઈ હતી. ધ્રુવે ૪૬, અચિને

૩૭ અને બુમરાહે ૨૬ રન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. રેહાન અહેમદ બે જ્યારે એન્ડરસન, હાર્ટલે અને રૂટે ૧-૧ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ તેની પ્રથમ ઈનિંગ્સની જોરદાર શરૂઆત કરી હતી ખાસ કરીને ડ્યુકેટે આક્રમક રમત બતાવી હતી અને કોવલે સાથે પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૮૯ રન ઉમેર્યા હતા. આ ભાગીદારી અચિને કોવલેને ૧૫ રને રજત પાટીદારના હાથમાં ઝિલાવીને તોડી હતી.

કોવલે અચિનેનો ૫૦૦મો ઈન્ટરનેશનલ શિકાર હતો. ડ્યુકેટ ઓલી પોપ સાથે મળીને ટીમને વધુ મજબૂત સ્થિતિમાં મૂકે એ પહેલાં સિરાજે તેને ૩૯ રને એલબીડબલ્યુ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ડ્યુકેટે માત્ર ૧૧૨ બોલમાં ૨૧ બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે ૧૩૩ રન બનાવી લીધા છે અને તે રમતમાં છે.

આઈસીસીની ૬૬૬ કાર્યવાહી

## ક્રિકેટર રિજવાન પર લગાવ્યો સાડા ૧૭ વર્ષનો પ્રતિબંધ

! અબુધાબી, તા.૧૬ ।

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મોટી કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચારી વિરોધી નિયમોના ઉલ્લંઘન માટે ક્રિકેટર પર સાડા ૧૭ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. આઈસીસીએ વર્ષ ૨૦૨૪માં યુએઈમાં રમાયેલી ટી૧૦ લીગ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘન માટે ક્લબ ક્રિકેટર રિજવાન જાવેદને દોષી ઠેરવ્યો છે. આઈસીસીએ વર્ષ ૨૦૨૪માં યુએઈમાં રમાયેલી ટી૧૦ લીગ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘન માટે ક્લબ ક્રિકેટર રિજવાન જાવેદને દોષી ઠેરવ્યો છે. સાથે અમીરાત ક્રિકેટ બોર્ડને ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના પાંચ અલગ-અલગ ઉલ્લંઘનો માટે દોષી ઠેરવી

છે. આઈસીસીએ જાણકારી આપતા કહ્યું- રિજવાન તે આઠ ખેલાડીઓ અને અધિકારીઓમાં સામેલ છે, જેણે આઈસીસીએ પાછલા વર્ષ સપ્ટેમ્બરમાં ૨૦૨૧ અબુધાબી ટી૧૦ ક્રિકેટ લીગ અને ભ્રષ્ટાચારના પ્રયાસોના સંબંધમાં ઈસીસી તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો. ICC આચાર સંહિતા સમિતિના ચેરમેન માર્કકલ જે બેલોફ કેસી, જે ઈસીસીની અનુશાસન પેનલના રૂપમાં કામ કરી રહ્યાં છે. રિજવાન આરોપોનો જવાબ આપી શક્યો નહીં.

ખાડેખથી નારાજ થયા હતા ક્રિકેટ ફેન્સ

## સરફરાઝ રનઆઉટ થતાં ખાડેખને થયો પરસ્તાવો, ઈન્સ્ટાગ્રામ પર માંગી માફી

! (એજન્સી) રાજકોટ, તા.૧૬ ।

ક્રિકેટના ઉભરતા યુવા સિતારા સરફરાઝ ખાનને લાંબા સમય બાદ તક મળી તો તેણે શાનદાર અડધી સદી ફટકારી દીધી. તેણે ઈનિંગની શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું અને ૪૮ બોલમાં ૫૦ રન પૂરા કર્યા હતા. પરંતુ આ વચ્ચે જાડેજા સાથે થયેલી ગેરસમજણને કારણે તે રનઆઉટ થઈ ગયો હતો. ત્યારબાદ આ રનઆઉટ માટે લોકો જાડેજાને દોષી ઠેરવવા લાગ્યા. હવે જાડેજાએ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ દ્વારા સરફરાઝની માફી માંગી છે. તેણે પોતાની એકાઉન્ટ પર સ્ટોરી બનાવતા લખ્યું કે સરફરાઝ ખાન માટે હું દુખ અનુભવી રહ્યો છું, આ મારી ભૂલને કારણે થયું છે. ખુબ સાડુ રમ્યો સરફરાઝ.હકીકતમાં રવિન્દ્ર જાડેજાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા મામલાનો

અંત આવી ગયો, જેમાં જાડેજાને આ રનઆઉટ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. જાડેજાએ તેના પર માફી માંગી લીધી છે. સાથે તેણે બેટિંગ માટે સરફરાઝની પ્રશંસા પણ કરી છે. કારણ કે સોશિયલ મીડિયા પર આ રનઆઉટને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હકીકતમાં ૬૬ બોલમાં ૬૨ રન બનાવી રમી રહેલો સરફરાઝ અચાનક તે સમયે રનઆઉટ થઈ ગયો જ્યારે ૮૯ રન પર બેટિંગ કરી રહેલા જાડેજા સાથે તે ગેરસમજણનો શિકાર બન્યો હતો અને ક્રિકેટ ફેન્સ દુઃખી થઈ ગયા હતા. આ ઘટના બાદ રોહિત શર્મા પણ રૂડિંગ રૂમમાં બેસી નારાજ થયો હતો. રોહિતે પોતાની કેપ ઉતારી નીચે ફેંકી દીધી હતી. તેનાથી સ્પષ્ટ હતું કે સરફરાઝ રનઆઉટ થયાથી કેટલો રોહિત શર્મા નારાજ થયો હતો. પરંતુ આ રનઆઉટ પર સરફરાઝે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

## હુથી બળવાખોરોએ અમેરિકાને નુકશાન પહોંચાડ્યું ઈરાન સમર્થિત હુથીઓને યુએસએ વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા હુથીઓ દ્વારા રાતા સમુદ્રમાં અમેરિકા અને બ્રિટનના જહાજો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા હતા

! (એજન્સી) વોશિંગટન, તા.૧૬ ।

ઈરાનના અધિકારીઓએ હુથીઓને યુદ્ધને કારણે ગાઝા અને પેલેસ્ટાઈનના યુદ્ધાઓને સમર્થન આપનારા યમનના હુથી બળવાખોરોએ અમેરિકા અને તેના સહયોગી દેશોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. રાતા સમુદ્રમાં એક પછી એક હુમલાઓને કારણે વેપારી જહાજોની અવર-જવર પર માઠી અસર થઈ અને તેના પગલે રાતા સમુદ્રના જળમાર્ગથી વેપાર કરતાં દેશોને મોટું નુકસાન સહન કરવામાં આવી રહ્યા હતા.

કરવું પડ્યું. આ સૌની વચ્ચે અમેરિકા અને તેના સહયોગી દેશોએ હુથીઓને કાબૂમાં લેવા માટે તેમના પર હવાઈ હુમલા પણ શરૂ કરી દીધા છે. હવે આ જ દિશામાં અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ હવે સત્તાવાર રીતે યમનના હુથી સંગઠનોને ફરી વૈશ્વિક આતંકી સમૂહ જાહેર કરી દીધું છે. હુથીઓ દ્વારા રાતા સમુદ્રમાં અમેરિકા અને બ્રિટનના જહાજો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા હતા.

## વિકેટકીપર બેટરની ફરી રણજી ટ્રોફીની મેચમાં ન રમ્યો ઈશાન કિશન સામે બીસીસીઆઈ શિક્ષાત્મક પગલાં લે તેવી શક્યતા

! (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ ।

વિકેટકીપર બેટર ઈશાન કિશન હાલ ભારતીય ટીમમાંથી બહાર છે અને છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમવાના કારણે તેનું નામ ચર્ચામાં છે. બોર્ડે તમામ ખેલાડીઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેની ઈશાન કિશનને ફરી એક વખત અવગણના કરતા તેનું કરિયર ખતરામાં આવી ગયું છે અને બોર્ડે તેના પર એક્શન પર લઈ શકે છે. નોંધનીય છે કે ઈશાન કિશનની રણજી ટ્રોફીમાં ગેરહાજરી ચાલુ છે અને તે આજે જમશેદપુરમાં શરૂ થયેલી અંતિમ રાઉન્ડની મેચમાં પણ ટીમનો ભાગ બન્યો ન હતો. હવે

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ઈશાન કિશન પર એક્શન લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બીસીસીઆઈએ ભારતીય ટીમમાં રમી રહેલા સેન્ટ્રલ ક્રોન્ડ્રાક્ટના ખેલાડીઓએ રણજી ટીમ સાથે જોડાવા માટે કહ્યું હતું. આ માટે બોર્ડે એક નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. બીસીસીઆઈએ કહ્યું હતું કે હવે તે આ માટે કોઈ બહાનું સહન કરશે નહીં. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ૧૪ ફેબ્રુઆરીએ રાજકોટ ટેસ્ટ મેચ પહેલા આની જાહેરાત કરી હતી. જય શાહના આ મેસેજથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી ઈશાન કિશન, કુશાલ પંડ્યા અને દીપક ચહરને પણ પોતપોતાની ઘરેલું ટીમ સાથે જોડાવાનું હતું.

## ભારતીયો પર હુમલા અંગે વ્હાઈટ હાઉસની પ્રતિક્રિયા અમેરિકામાં જાતિ, લિંગ, ધર્મ કે અન્ય કોઈ કારણસર થતી હિંસા સ્વીકાર્ય નથી રાષ્ટ્રપતિ જો બાઈડન અને સમગ્ર વહીવટીતંત્ર આવા હુમલાઓ સામે એલર્ટ હોવાનો મુખ્ય પ્રવક્તા જોન કિર્બીનો દાવો

! (એજન્સી) વોશિંગટન, તા.૧૬ ।

અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો અને વિદ્યાર્થીઓ પર થઈ રહેલા એક પછી એક હુમલાઓ અને મૃત્યુની ઘટનાઓ પર વ્હાઈટ હાઉસે પ્રતિક્રિયા આપી છે. વ્હાઈટ હાઉસે તરફથી આવી ઘટનાઓ પર ગાઢ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વ્હાઈટ હાઉસના મુખ્ય પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકામાં જાતિ, લિંગ, ધર્મ

કે અન્ય કોઈ કારણસર થતી હિંસા સ્વીકાર્ય નથી. અમે તેના સખત વિરોધી છીએ. રાષ્ટ્રપતિ જો બાઈડન અને સમગ્ર વહીવટીતંત્ર આવા હુમલાઓ સામે એલર્ટ છે. અમે અમેરિકન ધરતી પર આ પ્રકારના હુમલાને રોકવા માટે સતત કાર્યરત છીએ. ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થી વિવેક તનેજા (૪૧) ર ફેબ્રુઆરીએ રાતના ૨ વાગ્યાની આસપાસ કૂટપાથ પર પડેલો જોવા મળ્યો હતો. તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

# વિશેષ અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભા યોજઈ

# કેન્સરની સારવારની સાથોસાથ કેન્સર ન થાય તે માટે સજાગતા કેળવવાની વિશેષ જરૂર : રાજ્યપાલ આચાર્ય દેવપ્રતભુ

! (માહિતી) ગાંધીનગર ।  
ગુજરાત કેન્સર સોસાયટી દર્દીઓની શ્રેષ્ઠ સારવાર, કેન્સર વિષયમાં શ્રેષ્ઠ શિક્ષણ અને કેન્સર શ્રેય શ્રેષ્ઠ સંશોધન કરી રહી છે. સાથોસાથ સમાજે પણ કેન્સર ન થાય તે માટે વિશેષ સજાગતા કેળવવાની જરૂર છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવપ્રતભુએ આજે અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેતાં કહ્યું હતું કે, આપણા ખાનપાન અને આપણી જીવનશૈલીને કારણે કેન્સર જેવા મહારોગોનો વિસ્ફોટ થયો છે. કેન્સરની સારવારની સાથેસાથ કેન્સર ન થાય તે માટે જનજાગૃતિ કેળવવાની અત્યંત આવશ્યકતા છે.



રાજ્યપાલ શ્રી આચાર્ય દેવપ્રતભુએ કહ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી, સંસાધનો અને સાધનોની સહાયથી ગુજરાત કેન્સર સોસાયટી કેન્સરના દર્દીઓને અને તેમના પરિવારજનોને ઓળમાં ઓછું કષ્ટ પડે એ પ્રકારે નિસ્વાર્થ ભાવે માનવતાની મોટી સેવા કરી રહી છે. માત્ર ગુજરાત જ નહીં, ભારતભરના લોકો તેનો લાભ મેળવી રહ્યા છે.  
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવપ્રતભુએ કહ્યું કે, ભારતમાં વર્ષ-૨૦૨૨માં કેન્સરના ૧૪ લાખથી વધુ દર્દીઓ હતા. વર્ષ-૨૦૨૩માં આ આંકડો ૧૫ લાખ પહોંચ્યો છે. તે પૈકી ગુજરાતમાં કેન્સરના ૭૭ હજાર દર્દીઓ છે. બીમારીના ઉપચારની સાથોસાથ તે ન થાય તેના ઉપાયો પણ વિચારવા જોઈએ. આપણે

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ગુજરાત કેન્સર સોસાયટી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોટીની દીર્ઘદ્રષ્ટિ અને શ્રી પંકજભાઈ પટેલ તથા તેમના સાથીઓની મહેનતનું પરિણામ છે. ગુજરાત કેન્સર સોસાયટીમાં સુવિધાઓ માટે મોટું ધાન આપનાર ત્રણ ઠાંતાઓ; શ્રી સંદીપ અન્જિનિયર (એસ્ટ્રલ પાર્ઠિપ), શ્રી રાકેશભાઈ શાહ (કંચન ફામા) અને શ્રી જયંતીભાઈ પટેલ (મેઘમણી યુપુ) નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવપ્રતભુએ સન્માન કર્યું હતું. ગુજરાત કેન્સર સોસાયટીના અધ્યક્ષ શ્રી પંકજભાઈ પટેલ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે છેલ્લા છ દાયકાથી સોસાયટી કેન્સરના દર્દીઓની સારવાર અને કેન્સર પ્રત્યે જાગૃતિ કેળવવા પ્રયત્નશીલ છે કેન્સર નિદાન શિબિર અને તાત્કાલિક સારવાર ને વધુ પ્રોત્સાહન આપીને સોસાયટી કેન્સરના દર્દીઓની પીડા ઓછી કરવાનો હર સંભવ પ્રયાસ નિરંતર કરી રહી છે. તેમણે કહ્યું કે, ગુજરાત કેન્સર અનુસંધાન સંસ્થાન, ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, ડૉ. ડી બી પટેલ ડ્રુગ બેંક અને કોમ્યુનિટી કેન્દ્ર ના માધ્યમથી ગુજરાત કેન્સર સોસાયટી દર વર્ષે લગભગ ૮ લાખ ઓપીડી દર્દીઓ અને ૬૦,૦૦૦ ઈન્ડોર દર્દીઓને સેવા આપી રહી છે. ગુજરાત કેન્સર અનુસંધાન સંસ્થાન નવા પ્રોટોન કેન્દ્રની યોજના બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. ડૉ. ડી. બી. પટેલ ડ્રુગ સેન્ટરના માધ્યમથી એક લાખ જેટલા દર્દીઓને સહાયની વહીવટી દવાઓ આપવામાં આવી રહી છે.





ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોના મેજ પરથી...

પ્રકૃલ પાનશેરિયાના મેજ પર પુછાયેલા પ્રશ્નોનો ઉત્તર : ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને કોરોડની સહાય ચુકવાઈ

૧ ગાંધીનગર, તા.૧૬

મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના હેઠળ ઈજનેરી વિદ્યાર્થીઓને અપાતી સહાય સંદર્ભે ગૃહમાં પુછાયેલા પ્રશ્નોનો ઉત્તરમાં મંત્રી પ્રકૃલ પાનશેરિયાએ જણાવ્યું કે, આ યોજના રાજ્યમાં ૭મી ઓક્ટોબર ૨૦૧૫થી અમલી બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના અંતર્ગત ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા રાજ્યના ૩૨,૮૩૯ વિદ્યાર્થીઓને રૂ.૧૩૪.૦૩ કરોડની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૪,૩૬૬ વિદ્યાર્થીઓને રૂ.૮૮.૮૨ કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૮,૪૭૩ વિદ્યાર્થીઓને રૂ.૩૫.૧૧ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

શિક્ષણ મંત્રીએ કબુલ્યું, રૂપિયા લઈને ડીગ્રીઓ વેચાતી ગેરરીતિને અટકાવવા સમિતીની રચના કરાઈ સાબરમતી યુનિવર્સિટી દ્વારા નાણાં લઈને પી.એચ.ડી.ની તેમજ અન્ય ઉચ્ચ ડીગ્રીઓ અને સર્ટીફિકેટ સંદર્ભે ગૃહમાં શિક્ષણ મંત્રી પ્રકૃલ પાનશેરિયાએ જણાવ્યું કે, ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા ત્રણ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી હતી. જેના દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આવી ગેરરીતિ આચરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની ડિગ્રી પાછી મેળવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત-ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૯ હેઠળ ખાનગી યુનિવર્સિટીની અસરકારક દેખરેખ અને નિયંત્રણ માટે શિક્ષણ વિભાગ દ્વારા બે સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં (૧) ઉચ્ચ સ્તરીય એપેક્ષ કમિટી અને (૨) દેખરેખ નિરીક્ષણ, સમીક્ષા, અને તપાસણી સમિતીની રચના કરવામાં આવી છે.

ઝાકિંકેશ પટેલના મેજ પર પુછાયેલા પ્રશ્નોનો ઉત્તર: કોરોડના ખર્ચે ગીર સોમનાથમાં એક જનરલ હોસ્પિટલ, બે પેટા જિલ્લા હોસ્પિટલ, ૬ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૨૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાશે

ગીર સોમનાથ જિલ્લાના તલાલા ખાતે રૂ. ૫.૭૭ કરોડના ખર્ચે નવીન સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાશે તે માટે વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે. તલાલા ખાતે હાલ જે સી.એચ.સી કાર્યરત છે ત્યાં જ નવીન મકાનનું બાંધકામ કરવામાં આવનાર છે. ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે એ માટે એક જનરલ હોસ્પિટલ, બે પેટા જિલ્લા હોસ્પિટલ, છ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ૨૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. વેરાવળ ખાતે જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલમાં ૧૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ છે. ગીર ગઢડા અને ઉના તાલુકામાં બે પેટા જિલ્લા હોસ્પિટલો હાલ સી.એચ.સી ખાતે કાર્યરત છે. જે બંનેમાં ૫૦-૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ છે.

વેરાવળ જિલ્લા હોસ્પિટલમાં સ્ટાફની અછત માટે રાજ્યમાં બોન્ડેડ તબીબોના હુકમો કરી દેવાયા છે. પરંતુ અમુક જગ્યાએ તબીબો હાજર નથી થયા અને લાંબી રજા પર હોવાના કારણે થોડા પ્રશ્નો છે જેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને સત્વરે આ કામગીરી પૂર્ણ કરીને તબીબોનો મુકવાની કામગીરી કરવામાં આવશે.

૫૭૫ કરોડના ખર્ચે જાનનગર જી.જી.હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે

રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઝાકિંકેશ પટેલે જાનનગર જી.જી.હોસ્પિટલ એક્સપાન્શન સંદર્ભે જણાવ્યું છે કે, જી.જી.હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. જાનનગર સહિત પડોશી જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે. ૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માનુ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે. તેમજ ઓ.પી.ડી, આઈ.પી.ડી, રસીકરણ, ઈમરજન્સી સારવાર, આઈ.સી.યુ, ઓપરેશન, નિદાન, ડી.ઈ.આઈ.આર.સી. (ડિસ્ટ્રીક્ટ અલી ઈન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એન.આર.સી. (ન્યુટ્રિશનલ રીહેબિલિટેશન સેન્ટર), સ્પેશ્યલ વેલ બેબી કલીનિક, એડોલસન્ટ કલીનિક, વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલ પરિસરમાં વર્ષોજૂના બાંધકામ તોડીને નવીન હોસ્પિટલ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે.

મેડીકલ કોલેજમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી ૧ વર્ષની ગ્રામ્ય સેવાની સામે રૂ.૨૦.૦૦ લાખનો બોન્ડ લેવાય છે

ગૃહમાં આરોગ્ય મંત્રીએ બોન્ડ વસુલાત સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ કોર્પોસ, ગાંધીનગર ધ્વારા નીટ આધારીત મેરીટ બનાવી એવ લાઈન પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પ્રવર્તમાન નિતી મુજબ રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી ૧ વર્ષની ગ્રામ્ય સેવાની સામે રૂ.૨૦.૦૦ લાખનો બોન્ડ લેવામાં આવે છે. GMERS સંચાલિત મેડીકલ કોલેજો અને સ્વ-નિર્ભર મેડીકલ કોલેજોમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે એમ.વાય.એસ.વાય, કન્યા કેળવણી નિધિ, ફી-શિપ કાર્ડનો લાભ લઈ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પણ બોન્ડનિતી લાગુ પડે છે. રાજ્યમાં એમ.બી.બી.એસ. પાસ વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરે ત્યારબાદ તેમને ડીગ્રી સર્ટીફિકેટ આપવાની કાર્યવાહી જે તે યુનિવર્સિટી ધ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં એમ.બી.બી.એસ. પાસ કરેલ ઈન્ટર્નશીપ કરતા ઓક્ટરોને ગુજરાત મેડીકલ કાઉન્સિલ ધ્વારા પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ આપવામાં આવે છે. ઈન્ટર્નશીપ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીની પ્રોવિઝનલ ડીગ્રીના આધારે ફાઈનલ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. રાજ્યમાં હાલ કુલ ૩૬ મેડીકલ કોલેજો અને એક એઈમ્સ મેડીકલ કોલેજ કાર્યરત છે. જેમાં કુલ-૭૦૫૦ બેડો છે. તેમાં ૬-સરકારી, ૧૩- જીએમઈઆરએસ સંચાલિત, ૩-ન્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત, ૧૬- સ્વનિર્ભર મેડીકલ કોલેજો, ૧-ડીમ્સ યુનિવર્સિટી સંચાલિત અને ૧-એઈમ્સ રાજકોટ મેડીકલ કોલેજો કાર્યરત છે. તેમાં સરકારી મેડીકલ કોલેજોમાં ૧૪૦૦ બેડો, જીએમઈઆરએસ મેડીકલ કોલેજોમાં ૨૧૦૦, ન્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ કોલેજોમાં ૭૦૦, સ્વનિર્ભર કોલેજોમાં ૨૬૫૦, ડીમ્સ યુનિવર્સિટી કોલેજોમાં ૧૫૦ બેડો અને એઈમ્સ રાજકોટમાં ૫૦ બેડો છે.

ફર મીટરનો ફ્લાય ઓવર બ્રિજ પાંજરાપોળ જંકશન પર અંદાજે રૂ. ૮૬.૯૪ કરોડના ખર્ચે નિર્માણ થશે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે ૧૮૫ કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦ ફ્લાય ઓવર નિર્માણના નિર્ણય સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ૭ બ્રિજના રૂ. ૬૧૨.૮૬ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

! (માહિતી) અમદાવાદ, તા.૧૬ | મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંકશન તથા પંચવટી જંકશન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, ૬૫૨ મીટર લંબાઈ સાથે ૧૭ મીટર પહોળો પાંજરાપોળ જંકશન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે રૂ. ૮૬.૯૪ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. પંચવટી જંકશન પરનો ફ્લાય ઓવર રૂ. ૯૮.૧૮ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. તે ૭૭૯.૧૯ મીટર લંબાઈ ધરાવતો અને ૧૭ મીટર પહોળો બ્રિજ હશે. સ્વર્ણમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવરબ્રિજ ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં ૭૫ ફ્લાય ઓવર બનાવવાની સામે અમદાવાદ મહાનગરમાં ૨૦ ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો



છે. રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના ૭ ફ્લાય ઓવર બ્રિજ માટે રૂ. ૬૧૨.૮૬ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે. હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગર પાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે ૨૦૨૩-૨૪ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે. રાજ્ય સરકારે

શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા લાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ સરટેઈનેબલ અને કેપેબલ બનાવવા 'ઈઝ ઓફ લિવિંગ' પર ધ્યાન આપવાની નેમ રાખી છે. આ હેતુસર શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠી, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડો સુદૃઢ કરવા સહિતના શહેરી આયોજન અને વહીવટમાં ક્રોલિટીટીવ ચેન્જ માટે આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૨૧,૬૯૯ કરોડનું બજેટ ફાળવાયું છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ શહેરી વિકાસ સત્તામંડળોમાં બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસલિટીઝના કામો વધુ સંગીન બનાવવા આ વર્ષના બજેટમાં રૂ. ૮૬૭૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરોના સર્વાંગી વિકાસ માટેની સ્વર્ણમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ એટલે કે, ૨૦૨૬-૨૭ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૬ કચ્છમાં ૬ પોલીસ અધિકારી સહિત ૧૯ લોકો સામે ફરિયાદ

! (એજન્સી) અમદાવાદ, તા.૧૬ | ગુજરાતના પોલીસ બેડામાં બળભાંગ મચાવતી મોટી ખબર સામે આવી છે. ગુજરાત પોલીસ ફરી વિવાદમાં આવી છે. આ ખબરથી ગુજરાતના પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પર ફરી સંક્રાંતિમાં આવ્યા છે. કચ્છમાં ૬ પોલીસ અધિકારી સહિત ૧૯ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છ CID કાર્ડમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છના તાત્કાલિક SP, DYSP, PSI સહિત ઈલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ ૨૦૧૫ ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ સીઆઈડીએ ફરિયાદ નોંધી છે. પશ્ચિમ કચ્છ CIDએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ૨૦૧૫ના વર્ષનો આ બનાવ છે, જેમાં જીઝના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ફરિયાદ ના લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે. ફરિયાદીના અપહરણની ફરિયાદ પણ ના લેતા પોલીસ અધિકારીઓ સામે કેસ થયો છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. ગુજરાતના ૨ IPS અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો ગુજરાતના ૩ Dy.SP સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટના સહયોગથી ચાર દિવસીય STI R&D કેમ્પનો પ્રારંભ



! અમદાવાદ, તા.૧૬ | ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપકરમ સાયન્સ સિટીમાં ચાર દિવસીય STI R&D કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન (STI) નીતિના અમલીકરણ માટેની નોડલ એજન્સી GUJCOST દ્વારા પ્રથમ વખત આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પમાં સહભાગીઓને વિજ્ઞાન, ટેકનોલોજી અને આરોગ્ય ક્ષેત્રે ઉભરતી તકનીકો અને સામાજિક મુદ્દાઓના વિવિધ પાસાંઓ પર તાલીમ આપવામાં આવશે.

વેરાવળમાં પોલીસ અવળા ધંધા કરતી હોવાની વિધવાએ ફરિયાદનો ધાવી

! (એજન્સી) વેરાવળ, તા.૧૬ | ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલાએ બે પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાન સહિત ૪ વિરુદ્ધ શારીરિક શોષણ અને દાડૂ વેચવા હપતા લેતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ પોલીસ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે, કારણ કે થોડા સમય પહેલા દીવ નજીક ચેક પોસ્ટ પર ACB ટ્રેપ થતા ઉનાના પીઆઈ ગૌસ્વામી અને ASI સહિત અન્ય એક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા બળભાંગ મચ્યો હતો અને ઉના પીઆઈ ગૌસ્વામી હજુ પણ ભૂગર્ભમાં છે, ત્યારે ગીર ગઢડા ના એક ગામમાં રહેલી એક વિધવા મહિલા એ સનસની બેજ આરોપ સાથે ગીર ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિધવા પતિની ઇત્રછાયા ગુમાવ્યા બાદ બાળકોના ઉછેર માટે ગેરકાયદે ધંધો કર્યો હતો, જેના કારણે સલીમ નામનો પોલીસ કર્મી, મોહન મકવાણા જે પણ પોલીસ કર્મી છે અને એક સિવિલિયન જેનું નામ પરેશ છે આ ત્રણેય એ મહિલા પાસે બીભત્સ માંગણી કરી અને શરીર સુખ માણ્યું તેમજ આ મહિલાએ એક હોમગાર્ડના નામનો પણ ઉલ્લંઘ કર્યો છે. હનીફ નામનો હોમગાર્ડ જેણે આ મહિલા પાસે અનેક વખત બીભત્સ માંગણી કરી હતી.

રાજ્યના વિવિધ શહેરોમાંથી બનાવટી જથ્થો ઝડપાયો મે. પાર્થકન ફાર્મામાં ફૂડ વિભાગના દરોડા, ૧.૭૫ કરોડની એન્ટિબાયોટિક જપ્ત

! (એજન્સી) અમદાવાદ, તા.૧૬ | ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાયદેસર - બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં ડૉ. એચ. જી. કોશિયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના આર. એમ. પટેલ નાયબ કમિશનર (આઈ.બી.), વાય. છેલ દરજી, નાયબ કમિશનર (મુખ્ય મથક), વી. ડી. ડોબરીયા, મદદનીશ કમિશનર, અમદાવાદ ગ્રામ્ય, પ્રવર ઔષધ નિરીક્ષક એમ. આર.

મુગલપુરા અને તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મે. ફાર્માકેમ, મહારાજા હાઉસ, સેફ એક્ષપ્રેસની પાછળ, ચાંગોદર, અમદાવાદ ખાતે દિવ્યેશ જાગણી નામના ઈસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઈપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટિબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરી ટેબલેટ બનાવવાના જરૂરી મશીનો વસાવી મે. ફાર્માકેમ, અમદાવાદ ખાતેથી મે. પાર્થકન ફાર્મા પ્રા. લી. માર્કેટિંગ પેટીને બનાવટી-સ્પુરીયસ એન્ટિબાયોટિક્સ સહીતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા તંત્રની ટીમે ઝડપી પાડેલ અને તેઓને ત્યાંથી દવાઓના નમુના લીધા બાદ દવા બનાવવાનો કાર્યો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકીંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે.

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સાંસદ સી. આર. પાટીલે સભા સ્થળની વિઝિટ લીધી



! સુરત, તા.૧૬ | જિલ્લા કલેક્ટરશ્રી શ્રિપ્રા આગ્રેએ બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટેશન સહિતની વિસ્તૃત માહિતી પુરી પાડી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે ૨૨ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજનાના કાર્યક્રમ પૂર્વે નવસારીના સાંસદ અને પ્રદેશ સંગઠનના પ્રમુખશ્રી સી.આર. પાટીલે શુક્રવારે સભા સ્થળની મુલાકાત લીધી હતી. ટેકસટાઈલ ઉદ્યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે જિલ્લા કલેક્ટરશ્રી શ્રિપ્રા આગ્રેએ સાંસદશ્રી સી.આર.પાટીલને સભા સ્થળ પર થઈ રહેલી તૈયારી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. જેમાં સભા મંડપમાં વીવીઆઈપી, વીઆઈપી અને જનમેદનીની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ તેમજ ટ્રાન્સપોર્ટેશન સહિતની વિવિધ તૈયારી અંગે વાકેફ કર્યા હતા. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિકારી સુશીલ અગ્રવાલ, પ્રાયોજના હીલ્ડાઈટાઈ આનંદુ સુરેશ, અધિક કલેક્ટર કેતન જોશી અને જિલ્લા સંગઠનના પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement for Finoplex pipes and Nilkanth Steel, featuring product images and contact information for Nehal Mehta.

Advertisement for Mamta Solution, a housekeeping service, featuring an image of a person in a uniform and contact information.